



સ્થાપના ૧૯૫૮
www.alavibank.com

ALAVI

CO-OPERATIVE BANK LIMITED

સીઝર્વ બેન્ક લાયસન્સ નંબર
UBD/GJ/773/P(18. 12.1986)

રજીસ્ટર્ડ નંબર - ૧૫૨૫૯
સ્થાપના : ૦૧/૧૦/૧૯૫૮


65th

ANNUAL REPORT

2022-23

Period ending
March 31, 2023

આપણી સેવામાં સદાય તત્પર



ભારત 2023 INDIA

વસુધૈવ કુટુંબકમ્

ONE EARTH • ONE FAMILY • ONE FUTURE

Head Office

Wadi Chokhandi, Vadodara-17
Ph: 0265-2583933, 2582039
Fax : 0265 -2582245
info@alavibank.com

Ajwa Road

B/4, Bhanujyoti Society, Bahar
colony, Ajwa Road, Vadodara-19
Ph: 0265-2561871, 2510258
ajwa@alavibank.com

Fatehgunj

FF/1, The Emperor, Main Road,
Vadodara-02
Ph: 0265-2750027
fatehgunj@alavibank.com

Board of Directors



Shabbir M. Motorwala
Chief Executive Director / Ex-Chairman



Haji CA Akbar Z. Chasmawala (Chairman)



Talib S. Dawawala (Vice Chairman)



Zakirhusain F. Marchawala (Managing Director)



Aamena H. Bookbinder (Jt. Managing Director)



Ibrahim I. Vohra Advocate (Prof. Director)



Asgari A. Thakrawala (Director)



Yunusali B. Patel (Director)



Vohra Dilawar Fazalali (Director)



Taiyabali J. Dharmajwala (Director)



Mazhar I. Chinwala (Director)



Riyaz S. Godiwala (Director)



Mrs. CA Eleiya A. Surti
General Manager Incharge

Mrs. Naziya M. Siriwala
Accountant
Manager Branch - Ajwa Road

Mr. Abbasi S. Hathiwala
Manager Branch
Fatehgunj

ચેરમેન શ્રી નું નિવેદન

આદરણીય સભાસદ ભાઈઓ-બહેનો,

આજની દૃપ મી વાર્ષિક સાધારણ સભા ની રોનક વધારવા માટે આપણી અલવી કો.ઓપરેટીવ બેન્ક ના અત્રે ઉપસ્થિત મહાનુભાવો એવા અમુલ્ય સભાસદો, મહેમાનો, ઓડિટર સાહેબો, વકીલ સાહેબો, સમાજના આગેવાનો અને મને સતત મદદરૂપ થનાર મારા વ્યવસ્થાપક મંડળના સભ્યો નું હું તહેદીલ થી સ્વાગત કરું છું.

સને ૨૦૨૧-૨૨ ની જેમ સને ૨૦૨૨-૨૩ માં પણ બેન્ક ની નફાકારકતા માં ઉત્તરોત્તર વધારો નોંધાયેલ છે તેમાટે હું આપ સૌનો શુક્રગુઝાર છું. અમારા કાર્યકાળ ની શરૂઆત માં ૨૦૧૮ ના વર્ષ દરમિયાન કુલ સભાસદો ૧૧૬૪૫ હતા જે આજે ૨૦૨૩ ના વર્ષ ની પુર્ણતા સમયે કુલ નવીન સભાસદ ઉમેરો અને સભાસદ રાજીનામા અને સભાસદ મરણ ને અનુલક્ષીને કુલ સભાસદો ની સંખ્યા ૧૧૪૮૦ છે. ૨૦૧૮ માં બેન્કની કુલ થાપણો ૧૦૦.૦૦ કરોડ ની અંદર હતી જે ૨૦૨૩ અંતિત ૧૦૭.૭૨ કરોડ થવા પામેલ છે. બેન્કમાં કુલ ધિરાણ ૨૦૧૫ માં ૨૧૦૫.૪૫ લાખ હતું જે હાલ ૬૦૦૮.૧૦ થવા પામેલ છે. કુલ ધિરાણ રેશીયો ૨૨% થી હાલ ૫૧% થયેલ છે. બેન્ક નું કુલ એન.પી.એ ૨૦૧૮ ના વર્ષમાં ૬.૭૭% હતું જે હાલ રીકવરીના સઘન પ્રયાસો થકી ૬.૦% થવા પામેલ છે. સને ૨૦૧૮ માં કુલ ચોખ્ખો નફો ૮૭.૭૩ લાખ થી ૨૦૨૩ માં ૧૬૩.૬૪ લાખ (૨૦૧૮ ના વર્ષમાં કાચો નફો - ૧૭૦.૮૧ લાખ અને ૨૦૨૩ ના વર્ષમાં કાચો નફો - ૨૬૧.૧૦ લાખ) થવા પામેલ છે જે આપણા માટે ગૌરવ ની વાત છે. આવનાર વર્ષોમાં પણ આપ આપનો સાથ અને સહકાર આપી આપણી અલવી કો.ઓપરેટીવ બેન્કને બુલંદી પર લઈ જવામાં સહભાગી બનશો એવી દીલી ગુઝારીશ છે.

ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન આપણી બેન્કે નવી નવી સુવિધાઓ માં વધારો કરી રહેલ છે. બેન્કના ખાતેદારોના પોતાના ખાતાના ઇ-સ્ટેટમેન્ટ મોબાઈલ દ્વારા જોઈ શકે છે. ખાતું ધરાવનાર ના ખાતામાં કોઈપણ વ્યવહાર થયે તુરંત મોબાઈલ મારફતે એસ.એમ.એસ થકી જાણ થઈ શકે છે. આઈ.એમ.પી.એસ. ફેસીલીટી પણ શરૂઆત થઈ ગયેલ છે. બેન્ક દ્વારા નજીવા ખર્ચે લાઈટબીલ, ટેલિફોનબીલ, ડીશ ટીવી રીચાર્જ, વેરા બીલ ની ચુકવણી પણ કરી આપવામાં આવે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.

આજની સભા ના પ્રસંગે તમામ ખાતેદારોની લાગણી ને માન આપી મરણોત્તર સહાય રૂ.૧૦,૦૦૦/- થી વધારીને રૂ.૧૫,૦૦૦/- કરવામાં આવે છે. સમાજના વિદ્યાર્થીઓના ઉચ્ચ ભણતર ને ધ્યાને લઈ સભાસદો તથા ખાતેદારો માટે તમામ બેન્કસ કરતાં ખુબ જ ઓછા ૮% ના વ્યાજ દરે લોન આપવામાં આવશે. વાહન ખરીદવા માટે તેમજ ઢાળીના કરજ સામે તમામ સભાસદો તથા ખાતેદારોને ત્વરિત ધિરાણ આપવામાં આવશે જેની નોંધ લેશો. ગત સાલ ની જેમ આ વર્ષે પણ તમામ સભાસદો ને ૧૨% ડિવિડન્ડ આપવાનું જાહેર કરું છું.

નાણાકીય વર્ષ દરમિયાન રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા આપણી અલવી કો.ઓપરેટીવ બેન્કનું નેટવર્થ અને મુડી પર્યાપ્તતા ના ધોરણો ધ્યાને લઈ બેન્કને નાણાકીય રીતે સધ્ધર અને ખુબજ સારી રીતે સંચાલન કરનારી બેન્ક તરીકે સમાવેશ કરવામાં આવેલ છે જે બાબતે મને ચેરમેન તરીકે ગર્વ મહેસુસ થાય છે અને આ આપ તમામ ના નેક ઈરાદાના કારણે જ મુમકીન થયેલ છે.

નાણાકીય વર્ષ દરમિયાન બેન્કના અમુલ્ય સભાસદો, ખાતેદારો, ગ્રાહકો અને બેન્કની પ્રગતિમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહભાગી બનનાર તમામ વ્યક્તિઓને જાણ્યે-અજાણ્યે અગવડ પડી હોય તો હું તહેદીલ થી માફીનો તલબગાર છું.

આજની દૃપ મી વાર્ષિક સાધારણ સભા ના પ્રસંગે સભાસદો, ખાતેદારો, ગ્રાહકો, મારા કાર્યકાળ દરમિયાન મને બેન્કની પ્રગતિ માટે તમામ ખુણે સાથ અને સહકાર આપનાર મારા સાથી વ્યવસ્થાપક મંડળના સભ્યો, માનનીય રજીસ્ટ્રાર સાહેબશ્રીઓ, બેન્કમાં પારદર્શક ઓડિટ કરનાર સ્ટેચ્યુટરી અને કોન્કરન્ટ ઓડિટરશ્રીઓ, માનનીય રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ના સાહેબશ્રીઓ, ગુજરાત અર્બેન કો.ઓપરેટીવ બેન્ક ફેડરેશનના તમામ અધિકારીશ્રીઓ, જીલ્લા સહકારી સંઘ ના અધિકારીશ્રીઓ અને બેન્ક સાથે જોડાયેલ કરનાર તમામ રાષ્ટ્રીયકૃત તેમજ ખાનગી બેન્કના અધિકારીશ્રીઓ નો હું આજની સભામાં આભાર માનું છું.

આખરે બેન્કની પ્રગતિ માં સહભાગી બનનાર અને બેન્કને સતત આગળ ધપાવવા માટે અમારા વ્યવસ્થાપક મંડળ ને ચાવીરૂપ બેન્કની વિવિધ કમિટીઓ ના મેમ્બર્સ અને તમામ કમ્પ્યારીગણ નો આભાર માનું છું.

નાણાકીય વર્ષ પુર્ણ થવાના સાથે સાથે અમારા વ્યવસ્થાપક મંડળ નો પણ કાર્યકાળ પણ પુર્ણ થયેલ છે. આવનાર વ્યવસ્થાપક મંડળને પણ તમે સાથ અને સહકાર આપી હોંસલા અફઝાઈ કરશો તેવી ઉમ્મીદ છે.

આખરમાં અલવી બેન્કનું મુસ્તકબીલ બુલંદ છે અને સદા ઉજ્જવળ પર રહે એવી પાક પરવરદિગાર પાસે દોઆ.

શબ્દીરહુસેન એમ. મોટરવાલા

(ચેરમેનશ્રી)

સને ૨૦૨૨-૨૩ ના નાણાકીય વર્ષ માટે બેન્કના પ્રતિનિધિમંડળના અહેવાલ ની રજુઆત

આદરણીય સભાસદો, ગ્રાહકો અને સહકારી મિત્રો,

અસ્સલામુ અલયકુમ / નમસ્કાર,

આપ સૌની સાથે આપણી અલવી કો.ઓપરેટીવ બેન્ક પોતાની સફળ કારકીર્દી ના ૬૪ વર્ષ સતત મહેનત, નીડરતા અને સંઘર્ષભર્યા સફર ની યાદો ના સથવારે પુર્ણ કરી ગર્વભરે ૬૫ માં વર્ષ માં પ્રવેશી અનેકાનેક સિધ્ધિઓ મેળવવાના શુભ આશય થી સતત કાર્ય કરી રહેલ છે. આજની ૬૫મી વાર્ષિક સાધારણ સભાના સોનેરી અવસર માં ઉપસ્થિત આપ સભાસદોને બેન્કની અભુતપુર્વ કામગીરી દ્વારા થયેલ પ્રગતિ અને વિકાસ ની જાણકારી રજુ કરવા માટે હૃદયપુર્વક સ્વાગત કરું છું તેમજ તારીખ ૩૧/૦૩/૨૦૨૩ ના રોજ પુરા થતા વર્ષના કામકાજનો અહેવાલ, ઓડીટ થયેલા અને વ્યવસ્થાપક મંડળ દ્વારા મંજૂર કરેલ હિસાબો, અન્વેષક રીપોર્ટ તેમજ અન્ય માહિતી બોર્ડ વતી આપની સમક્ષ અત્રે દર્શાવેલ સંક્ષિપ્તમાં વિવરણ રજુ કરેલ છે, જે રજુ કરતા હું ગર્વની લાગણી અનુભવું છું.

સભાસદો:	માર્ચ ૨૦૨૨ આખરે સભાસદોની સંખ્યા ૧૧,૪૪૫ ની હતી જેમાં વર્ષ દરમ્યાન ૧૫૮ નવા સભાસદોનો વધારો થતાં તેમજ ૧૨૩ સભાસદો કમી થતાં માર્ચ-૨૦૨૩ આખરે સભાસદોની સંખ્યા ૧૧,૪૮૦ ની થયેલ છે. નોમીનલ સભાસદોની સંખ્યા માર્ચ-૨૦૨૩ આખરે ૮૩૭ ની થયેલ છે.
શેર ભંડોળ:	આપણી બેંકનું માર્ચ ૨૦૨૨ આખરે ભરપાઈ થયેલ શેર ભંડોળ રૂ.૩,૧૭,૦૮,૮૪૦.૦૦ નું હતું જેમાં વર્ષ દરમ્યાન રૂ.૨૭,૫૪,૩૮૦.૦૦ નો વધારો થતાં માર્ચ ૨૦૨૩ આખરે ભરપાઈ થયેલ શેર ભંડોળ રૂ.૩,૪૪,૬૩,૨૨૦.૦૦ થયેલ છે.
કાર્યકારી ભંડોળ:	માર્ચ-૨૦૨૨ આખરે બેંકનું કાર્યકારી ભંડોળ રૂ.૧,૪૧,૩૮,૩૮,૮૮૭.૦૨ નું હતું. જેમાં વર્ષ દરમ્યાન રૂ.૧,૧૭,૪૦,૦૮૮.૨૬ નો વધારો થતાં માર્ચ-૨૦૨૩ આખરે કાર્યકારી ભંડોળ રૂ.૧,૪૨,૫૫,૭૮,૮૮૫.૨૮ થયેલ છે.
રીઝર્વ તથા અન્ય ફંડો:	માર્ચ-૨૦૨૨ આખરે બેંકના રીઝર્વ તથા અન્ય ફંડ રૂ.૨૫,૫૮,૧૨,૫૪૭.૬૨ ના હતા જેમાં વર્ષ દરમ્યાન રૂ.૧,૧૫,૬૮,૬૭૮.૬૪ નો વધારો થતાં માર્ચ-૨૦૨૩ આખરે રીઝર્વ તથા અન્ય ફંડો રૂ.૨૬,૭૪,૮૨,૨૨૭.૨૬ થયેલ છે. જે બેંકના સને ૨૦૨૧-૨૨ ના ચોખ્ખા નફાની ફાળવણી અને ૨૦૨૨-૨૩ ના કાચા નફા માંથી ફાળવેલ રકમ ના કારણે જોવા મળેલ છે.
થાપણો:	માર્ચ-૨૦૨૨ આખરે બેંકની કુલ થાપણો રૂ. ૧,૦૬,૭૫,૫૮,૭૦૪.૫૨ ની હતી, જેમાં વર્ષ દરમ્યાન રૂ. ૮૬,૩૩,૮૬૩.૫૨ નો વધારો થતાં માર્ચ - ૨૦૨૩ આખરે રૂ. ૧,૦૭,૭૧,૮૨,૬૬૮.૦૪ થયેલ છે. નફાકારકતા CASA આધારિત હોવાથી બેંક દ્વારા સતત બચત અને ચાલુ ખાતા ખુલે તેવા સઘન પ્રયાસો દ્વારા બચત તથા કરંટ થાપણોમાં રકમનો સતત વધારો તેમજ બેંકની મુદતી થાપણો માં પણ વધારો નોંધાયેલ છે. સતત વિકાસ કરતી બેન્ક તરીકે આપણી અલવી કો.ઓપરેટીવ બેન્ક વડોદરા શહેરમાં મોખરાનું સ્થાન ધરાવે છે જે આપ સૌના કારણે જ શક્ય બનેલ છે.
કરજ:	નાણાકીય બાબતમાં આપણી બેન્ક સ્વનિર્ભર હોવાથી બહારથી કરજ મેળવવાની જરૂર પડતી નથી. આકસ્મિક જરૂરિયાત સમયે બેન્કે પોતાની થાપણો ઉપર જરૂરી સવલતો મળી રહે તેવી વ્યવસ્થા કરેલ છે.
ધિરાણો:	બેન્કની આવક ના મુખ્ય આધાર ગણાતા ધિરાણ માં પણ વધારો નોંધાયેલ છે. માર્ચ ૨૦૨૨ આખરે બેંકનું કુલ ધિરાણ રૂ.૪૮,૧૮,૮૬,૭૮૮.૮૫ હતું. જેમાં વર્ષ દરમ્યાન રૂ.૫,૫૭,૨૬,૮૫૬.૮૭ નો વધારો થયેલ છે અને વર્ષ દરમિયાન ધિરાણ ખાતેદારો દ્વારા નિયમિત ચુકવણી અને વસુલાત થતાં માર્ચ ૨૦૨૩ આખરે કુલ ધિરાણ રૂ.૫૩,૭૭,૧૩,૭૪૫.૮૨ થયેલ છે, બેંક ના તમામ પ્રકારના ગ્રાહકોના લાભાર્થે વિદેશ ભણતર માટે જનાર વિદ્યાર્થીઓ માટે ભણતર લોન તેમજ બેંકના સભાસદો તેમજ અન્ય ગ્રાહકો ની તમામ પ્રકારની જરૂરીયાતોને ધ્યાને લઈ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાઓ, મહિલા ઉત્કર્ષ યોજનાઓ તથા ગ્રૂપ ધિરાણ દ્વારા જરૂરીયાતમંદ ભાઈ/બહેનોને તમામ પ્રકારની ધિરાણોની સવલતો ખુબજ ઓછા સમયમાં અને નજીવા દરે પુરી પાડવામાં આવે છે. ધિરાણ ક્ષેત્રે તીવ્ર હરિફાઈ તેમજ બજારમાં પ્રવર્તમાન મંદી અને ચોકીર ઉદભવેલ અછતની પરિસ્થિતિમાં બેન્ક દ્વારા ધિરાણ દરો માં પણ સતત ઘટાડો કરવામાં આવેલ છે જેથી તમામ વર્ગના વ્યક્તિઓ ને વ્યવહારીક, સહકારી અને મદદરૂપ રહે તે ધ્યાન રાખવાનો તમામ વ્યવસ્થાપક મંડળનો હકારાત્મક અભિગમ દર્શાવે છે. બેંકે રીઝર્વ બેંક દ્વારા નક્કી કરેલ અગ્રિમક્ષેત્ર તેમજ નબળા વર્ગ (પ્રાયોરીટી સેક્ટર તથા વિકર સેકસન) ના ધિરાણો મંજૂર કરવાનાં લક્ષ્યાંકો સિદ્ધ કરેલ છે જેથી બેંકના તમામ પ્રકારના ધિરાણમાં વ્યાજના સ્પર્ધાત્મક દરના લીધે બેંકનો કેડિટ ડીપોઝીટ રેશીયો ૪૮.૮૨% થયેલ છે.

રોકાણો:	બેંક દ્વારા ફાજલ નાણાંનું રોકાણ કાયદાની જોગવાઈઓ અનુસાર કરવાના થતાં રોકાણો તેમજ ધિરાણો અંગેની નિર્ણાયક નિતિ નક્કી કરી ભંડોળની ફાળવણી કર્યા પછી બેંક પાસે રહેલ ફાજલ ભંડોળનું રોકાણ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની વખતો વખતની માર્ગદર્શક સુચનાઓ, ગુજરાત રાજ્ય સહકારી કાયદાની કલમ ૭૧ હેઠળ માન્યતા પ્રાપ્ત નાણાંકીય સંસ્થાઓ, રાષ્ટ્રીયકૃત બેંકો અને જલ્લા સહકારી તથા રાજ્ય સહકારી બેંકોમાં નીચે મુજબના રોકાણો મહત્તમ વળતર મળે તે રીતે કરવામાં આવેલ છે. <table border="1" data-bbox="487 346 1453 577"> <tr> <td>માન્ય ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા સિક્યોરીટીમાં</td><td>રૂ. ૬૨,૨૩,૦૪,૭૩૭.૦૦</td></tr> <tr> <td>અન્ય બેંકોમાં મુદતી થાપણોના રોકાણોમાં</td><td>રૂ. ૧૬,૬૦,૪૮,૬૬૭.૦૦</td></tr> <tr> <td>રાજ્ય અને જલ્લા સહકારી બેંકના શેરમાં</td><td>રૂ. ૫,૨૫૦.૦૦</td></tr> <tr> <td>અન્ય રોકાણોમાં</td><td>રૂ. -</td></tr> <tr> <td>કુલ રોકાણો.....</td><td>રૂ. ૭૮,૮૩,૫૮,૬૫૪.૦૦</td></tr> </table> બેંકના રોકાણોમાં ગત વર્ષની તુલનાએ વર્ષ દરમિયાન રૂ. ૧,૪૫,૧૪,૪૮૭.૨૨ નો ઘટાડો થયેલ છે જે ધિરાણો આપવાના કારણે દર્શિત થાય છે. તમામ રોકાણોની સલામતી માટે બેંક સતત પ્રયત્નશીલ છે.	માન્ય ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા સિક્યોરીટીમાં	રૂ. ૬૨,૨૩,૦૪,૭૩૭.૦૦	અન્ય બેંકોમાં મુદતી થાપણોના રોકાણોમાં	રૂ. ૧૬,૬૦,૪૮,૬૬૭.૦૦	રાજ્ય અને જલ્લા સહકારી બેંકના શેરમાં	રૂ. ૫,૨૫૦.૦૦	અન્ય રોકાણોમાં	રૂ. -	કુલ રોકાણો.....	રૂ. ૭૮,૮૩,૫૮,૬૫૪.૦૦
માન્ય ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા સિક્યોરીટીમાં	રૂ. ૬૨,૨૩,૦૪,૭૩૭.૦૦										
અન્ય બેંકોમાં મુદતી થાપણોના રોકાણોમાં	રૂ. ૧૬,૬૦,૪૮,૬૬૭.૦૦										
રાજ્ય અને જલ્લા સહકારી બેંકના શેરમાં	રૂ. ૫,૨૫૦.૦૦										
અન્ય રોકાણોમાં	રૂ. -										
કુલ રોકાણો.....	રૂ. ૭૮,૮૩,૫૮,૬૫૪.૦૦										
નોન પરફોર્મિંગ એસેટ્સ અને જોગવાઈ તથા રીકવરી મેનેજમેન્ટ:	રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા લાગુ કરવામાં આવેલ અસ્કયામતોના વર્ગિકરણ અને જોગવાઈઓના ધોરણોનું ચુસ્તપણે પાલન કરી તેમજ એન.પી.એ. સામે પર્યાપ્ત જોગવાઈ કરેલ છે. બેન્ક દ્વારા એન.પી.એ. થયેલ ધિરાણ ની વસુલાત માટે બેન્કના તમામ કર્મચારીગણ ના સઘન પ્રયત્નો દ્વારા ૧૮૬.૮૧ લાખની વસુલાત મેળવેલ છે, જેમા વર્ષ ૨૦૨૨ આખર કુલ ધિરાણોની રકમ રૂ. ૪,૮૧૮.૮૭ લાખ સામે બેંકનું ગ્રોસ એન.પી.એ. રૂ. ૩૪૦.૦૩ લાખ (૭.૦૫%) છે અને બેન્ક તેને ઘટાડવા સતત પ્રયત્નશીલ છે. ગ્રોસ એન.પી.એ. સામેની જરૂરી જોગવાઈની રકમ રૂ. ૧૫૪.૧૩ લાખ સામે બેંક દ્વારા રૂ. ૧,૦૭૧.૪૩ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે એટલે કે જરૂરીયાત કરતાં પણ વધુ જોગવાઈ કરી હોવાથી આપણી બેંકનું નેટ એન.પી.એ. ૦.૦૦% છે જે છેલ્લાં ઘણાં વર્ષોથી આપણે જાળવી રાખવામાં સફળ થયેલ છે.										
વિમા કવચ:	રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સહાયક ડીપોઝિટ ઈન્સ્યુરન્સ એન્ડ કેડિટ ગેરન્ટી કોર્પોરેશનના તા.૦૫/૦૨/૨૦૨૦ ના નોટીફિકેશન મુજબ બેંકના થાપણદારોને રૂ. ૫.૦૦ લાખ સુધીની તમામ થાપણોને સ્કીમ હેઠળ આવરી લેવામાં આવેલ છે, જેને બેંક દ્વારા વિમા પ્રિમીયમની રકમ દર છ માસે નિયમિત રીતે ભરપાઈ કરવામાં આવે છે. બેંકે સપ્ટેમ્બર-૨૦૨૩ સુધીનું એડવાન્સ પ્રિમીયમ રૂ. ૭,૭૬,૬૭૭.૪૨ તા. ૧૬/૦૫/૨૦૨૩ ના રોજ નિયત સમયમાં ભરપાઈ કરેલ છે.										
મરણોત્તર સહાય:	અહેવાલના વર્ષ દરમિયાન કુલ ૭૫ સભાસદોના મૃત્યુ થયેલ હોય તેમના વારસદારોને રૂ. ૧૧,૨૫,૦૦૦/- ની મરણોત્તર સહાય આપવામાં આવેલ છે.										
સ્ટાફ લીવ એન્કેશમેન્ટ:	બેંકના કર્મચારીઓની પડતર હકક રજાઓની જોગવાઈ અંતર્ગત અહેવાલના વર્ષ દરમિયાન બેંક દ્વારા કર્મચારીઓની પડતર હકક રજાઓની કુલ જોગવાઈના તફાવતની રકમ રૂ. ૧૦,૦૮,૦૩૬.૦૦ ની જોગવાઈ કરવામાં આવેલ છે.										
ઓડીટ:	અહેવાલના વર્ષ દરમિયાન બેંકનું સ્ટેચ્યુટરી ઓડીટ મેસર્સ એસ.એફ.તાઈ એન્ડ એસોસીએટ્સ, વડોદરા તેમજ આંતરીક ઓડીટ મેસર્સ અમીન પરીખ એન્ડ કું.વડોદરા દ્વારા કરવામાં આવેલ છે. જેમાં બેંકના સ્ટેચ્યુટરી ઓડિટરશ્રી એ આપણી બેંકને બેન્કીંગ ક્ષેત્રે કરેલ પ્રગતિમાં પુરો સંતોષ વ્યક્ત કરી બેંકનો ઓડીટ વર્ગ “અ” ચાલુ રાખ્યો છે. આગામી સને ૨૦૨૩-૨૪ ના વર્ષ માટે રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ના તા.૨૭/૦૭/૨૦૨૨ ના પત્ર ક્રમાંક AMD.DOS.MAG.ACG& LEGAL.No.S439/02-16-028/2022-2023 અન્વયે મેસર્સ એસ.એફ.તાઈ એન્ડ એસોસીએટ્સ ની સ્ટેચ્યુટરી ઓડિટર તરીકે નિમણૂક કરવામાં આવેલ છે.										
ડીવીડન્ડ:	બેંકના વ્યવસ્થાપક મંડળે સહકારી કાયદાની જોગવાઈ અનુસાર ચાલુ સાલ ૨૦૨૨-૨૩ ના વર્ષ માટે સભાસદોની શેર મુડી પર ૧૨% લેખે ડીવીડન્ડ આપવા ભલામણ કરેલ છે, જે સામાન્ય સભાની બહાલીએ જાહેરાત કરી ચુકવવામાં આવશે. સભાસદો ને જણાવતા ખુશી થાય છે કે તેઓને પાછલા વર્ષ ની ચુકવણી મુજબ તેઓના ડીવીડન્ડની ચુકવણી તેઓના ખાતાઓમાં કરવામાં આવશે. ખાતુ ન ધરાવતા સભાસદોએ તેઓના બાકીના ડીવીડન્ડની રકમ વાડી શાખાના શેર વિભાગમાંથી મેળવી લેવા વિનંતી. પાછલા ત્રણ વર્ષના ચુકવ્યા વગરના ડીવીડન્ડ ની રકમ બેંકના પેટા કાયદા ની કલમ ૪૨ (૧) મુજબ સ્ટેચ્યુટરી રીઝર્વ ફંડ ખાતે લઈ જવામાં આવશે.										

મૂડી પર્યાપ્તતા રેશીયો:	રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા દ્વારા અર્બન કો-ઓપ. બેંકમાં CRAR નાં ધોરણો લાગુ પાડવામાં આવેલ છે, જે નિયમાનુસાર નાગરીક સહકારી બેંકોએ આ ગુણોત્તર લઘુત્તમ ૯% હાંસલ કરવાનો હોય છે. જેની સામે આપણી બેંકે તારીખ ૩૧/૦૩/૨૦૨૩ અંતિત ૩૦.૯૮% હાંસલ કરેલ છે. જે ખૂબ જ પ્રસંશનીય ગણી શકાય.																																													
નફાની ફાળવણી:	અહેવાલના વર્ષ દરમ્યાન પ્રગતિના પંધે આગળ વધી બેંકની કુલ આવક રૂા.૨,૬૧,૦૮,૬૭૫.૧૮ થયેલ છે. આ આવકમાંથી ચુકવેલ વ્યાજ, ખર્ચ, ફી, જોગવાઈઓ તથા ટેક્ષની રકમ મળીને થતી કુલ રકમ રૂા.૯૭,૧૫,૪૧૬.૦૦ બાદ કરતાં બેંકનો ચોખ્ખો નફો રૂા.૧,૬૩,૯૪,૨૫૯.૧૮ બાકી રહે છે જેની ફાળવણી સહકારી કાયદા તેમજ બેન્કના પેટા કાયદા પ્રમાણે નીચે મુજબ કરવા બોર્ડ આપને ભલામણ કરે છે. <table><tr><th>અ.નં.</th><th>વિગત</th><th>રકમ રૂ</th></tr><tr><td colspan="3">પેટા કાયદાની કલમ ૪૧/૪૧(એ) મુજબ ફાળવણી</td></tr><tr><td>૧</td><td>સ્ટેચ્યુટરી રીઝર્વ ફંડ (ચોખ્ખા નફાના ૨૫% મુજબ)</td><td>૪૦,૯૮,૫૬૫.૦૦</td></tr><tr><td>૨</td><td>શકમંદ લેણાં ફંડ (સહકારી કાયદા ની કલમ ૬૭એ સુધારા પ્રમાણે ૮%)</td><td>૧૩,૧૧,૫૪૧.૦૦</td></tr><tr><td>૩</td><td>ડીવીડન્ડ સમકારી ફંડ (ભરપાઈ થયેલ શેરભંડોળના મહત્તમ ૧૨% પ્રમાણે)</td><td>૩,૩૦,૫૨૫.૦૦</td></tr><tr><td>૪</td><td>ડીવીડન્ડ ૧૨% લેખે (સામાન્ય સભાની મંજૂરીએ)</td><td>૩૮,૧૦,૪૬૩.૦૦</td></tr><tr><td>૫</td><td>ઈન્વેસ્ટમેન્ટ ફલકયુએશન રીઝર્વ</td><td>૨૫,૦૦,૦૦૦.૦૦</td></tr><tr><td>૬</td><td>શિક્ષણ ફાળો</td><td>૨,૦૦,૦૦૦.૦૦</td></tr><tr><td colspan="3">પેટા કાયદાની કલમ ૪૧(બ) મુજબ ફાળવણી (બાકીના નફાના)</td></tr><tr><td>૧</td><td>સામાન્ય કલ્યાણનિધી ફંડ (૨૦% મુજબ)</td><td>૮,૦૮,૬૩૩.૦૦</td></tr><tr><td>૨</td><td>સભાસદ કલ્યાણનિધી ફંડ (૨૦% મુજબ)</td><td>૮,૦૮,૬૩૩.૦૦</td></tr><tr><td>૩</td><td>ઘર્માદા કામ માટે (૧૦% મુજબ)</td><td>૪,૦૪,૩૧૭.૦૦</td></tr><tr><td>૪</td><td>સહકાર પ્રચાર (૫% મુજબ)</td><td>૨,૦૨,૧૫૮.૦૦</td></tr><tr><td>૫</td><td>બિલ્ડીંગ ફંડ (બાકીના)</td><td>૧૮,૧૮,૪૨૪.૧૮</td></tr><tr><td colspan="2">ચોખ્ખો નફો કુલ રૂપિયા</td><td>૧,૬૩,૯૪,૨૫૯.૧૮</td></tr></table>	અ.નં.	વિગત	રકમ રૂ	પેટા કાયદાની કલમ ૪૧/૪૧(એ) મુજબ ફાળવણી			૧	સ્ટેચ્યુટરી રીઝર્વ ફંડ (ચોખ્ખા નફાના ૨૫% મુજબ)	૪૦,૯૮,૫૬૫.૦૦	૨	શકમંદ લેણાં ફંડ (સહકારી કાયદા ની કલમ ૬૭એ સુધારા પ્રમાણે ૮%)	૧૩,૧૧,૫૪૧.૦૦	૩	ડીવીડન્ડ સમકારી ફંડ (ભરપાઈ થયેલ શેરભંડોળના મહત્તમ ૧૨% પ્રમાણે)	૩,૩૦,૫૨૫.૦૦	૪	ડીવીડન્ડ ૧૨% લેખે (સામાન્ય સભાની મંજૂરીએ)	૩૮,૧૦,૪૬૩.૦૦	૫	ઈન્વેસ્ટમેન્ટ ફલકયુએશન રીઝર્વ	૨૫,૦૦,૦૦૦.૦૦	૬	શિક્ષણ ફાળો	૨,૦૦,૦૦૦.૦૦	પેટા કાયદાની કલમ ૪૧(બ) મુજબ ફાળવણી (બાકીના નફાના)			૧	સામાન્ય કલ્યાણનિધી ફંડ (૨૦% મુજબ)	૮,૦૮,૬૩૩.૦૦	૨	સભાસદ કલ્યાણનિધી ફંડ (૨૦% મુજબ)	૮,૦૮,૬૩૩.૦૦	૩	ઘર્માદા કામ માટે (૧૦% મુજબ)	૪,૦૪,૩૧૭.૦૦	૪	સહકાર પ્રચાર (૫% મુજબ)	૨,૦૨,૧૫૮.૦૦	૫	બિલ્ડીંગ ફંડ (બાકીના)	૧૮,૧૮,૪૨૪.૧૮	ચોખ્ખો નફો કુલ રૂપિયા		૧,૬૩,૯૪,૨૫૯.૧૮
અ.નં.	વિગત	રકમ રૂ																																												
પેટા કાયદાની કલમ ૪૧/૪૧(એ) મુજબ ફાળવણી																																														
૧	સ્ટેચ્યુટરી રીઝર્વ ફંડ (ચોખ્ખા નફાના ૨૫% મુજબ)	૪૦,૯૮,૫૬૫.૦૦																																												
૨	શકમંદ લેણાં ફંડ (સહકારી કાયદા ની કલમ ૬૭એ સુધારા પ્રમાણે ૮%)	૧૩,૧૧,૫૪૧.૦૦																																												
૩	ડીવીડન્ડ સમકારી ફંડ (ભરપાઈ થયેલ શેરભંડોળના મહત્તમ ૧૨% પ્રમાણે)	૩,૩૦,૫૨૫.૦૦																																												
૪	ડીવીડન્ડ ૧૨% લેખે (સામાન્ય સભાની મંજૂરીએ)	૩૮,૧૦,૪૬૩.૦૦																																												
૫	ઈન્વેસ્ટમેન્ટ ફલકયુએશન રીઝર્વ	૨૫,૦૦,૦૦૦.૦૦																																												
૬	શિક્ષણ ફાળો	૨,૦૦,૦૦૦.૦૦																																												
પેટા કાયદાની કલમ ૪૧(બ) મુજબ ફાળવણી (બાકીના નફાના)																																														
૧	સામાન્ય કલ્યાણનિધી ફંડ (૨૦% મુજબ)	૮,૦૮,૬૩૩.૦૦																																												
૨	સભાસદ કલ્યાણનિધી ફંડ (૨૦% મુજબ)	૮,૦૮,૬૩૩.૦૦																																												
૩	ઘર્માદા કામ માટે (૧૦% મુજબ)	૪,૦૪,૩૧૭.૦૦																																												
૪	સહકાર પ્રચાર (૫% મુજબ)	૨,૦૨,૧૫૮.૦૦																																												
૫	બિલ્ડીંગ ફંડ (બાકીના)	૧૮,૧૮,૪૨૪.૧૮																																												
ચોખ્ખો નફો કુલ રૂપિયા		૧,૬૩,૯૪,૨૫૯.૧૮																																												
આભાર દર્શન:	બેંકના બેન્કની થાપણો તથા ધિરાણો માં નોંધપાત્ર વધારો થયેલ છે તે બદલ સમગ્ર સભાસદો, ગ્રાહકો, ખાતેદારો તેમજ સંચાલક મંડળના સાથી મિત્રોનો આભારી છું બેન્કની સધ્ધરતા ટકાવી રાખવામાં જેમનું મહત્વનું યોગદાન છે તેવા સમગ્ર સ્ટાફ પરિવારને આ તબક્કે સંચાલક મંડળ વતી ખુબજ ધન્યવાદ પાઠવું છું. બેંકને જરૂરી માર્ગદર્શન આપવા બદલ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના અધિકારીશ્રીઓમ રજીસ્ટ્રાર શ્રી વડોદરા, જિલ્લા રજીસ્ટ્રાર શ્રી સહકારી મંડળીઓ, જિલ્લા રજીસ્ટ્રાર શ્રી, ગાંધીનગર, ગુજરાત અર્બન કો.ઓપરેટીવ બેન્કસ ફેડરેશન, ધી બરોડા અર્બન કો.ઓપરેટીવ બેન્કસ ફેડરેશન નો બેંક વતી આભાર વ્યક્ત કરું છું. અંતમાં આવનાર વર્ષોમાં આપ સર્વેના સાથ-સહકારથી વધારે લોકાભિમુખ બની પરસ્પર ના સહકારથી આપણી બેન્કની પ્રતિષ્ઠાને ઉચ્ચ શિખરે લઈ જઈએ તેવી શુભેચ્છા સહ સભાસદો, થાપણદારો અને ખાતેદારો દ્વારા બેન્કના સંચાલન મંડળ ઉપરના વિશ્વાસ અને સહયોગ ની નોંધ લઈ સર્વેનો આભાર વ્યક્ત કરું છું.																																													
સ્થળ : વડોદરા તારીખ : XX/૦૮/૨૦૨૩	બોર્ડ ઓફ ડીરેક્ટર્સ વતી ચેરમેનશ્રી શબ્બીરહુસેન એમ. મોટરવાલા અલવી કો-ઓપરેટીવ બેંક લિ., વડોદરા																																													

INDEPENDENT AUDITOR'S REPORT

To,

The Members,

Alavi Co-operative Bank Ltd.

Report on the Financial Statements

We have audited the accompanying Financial Statements of Alavi Co-operative Bank Limited ("the Bank"), which comprises the Balance Sheet as at March 31, 2023, the Profit and Loss Account for the year then ended and a summary of significant accounting policies and other explanatory information (collectively referred to as the "financial statements").

Opinion

In our opinion and to the best of our information and according to the explanations given to us, the aforesaid financial statements together with the notes, give the information required by the Banking Regulation Act, 1949, as well as The Gujarat Co-operative Societies Act, 1961 and rules made thereunder, and the guidelines issued by Reserve Bank of India and the Central Registrar of Co-operative Societies in the manner so required for the Urban Co-operative Bank and are in conformity with accounting principles generally accepted in India and give a true and fair view of the state of affairs of the Bank as at March 31, 2023 and its Profit for the year ended on that date.

Basis for Opinion

We conducted our audit in accordance with the Standards on Auditing (SAs) issued by Institute of Chartered Accountants of India (ICAI). Our responsibilities under those Standards are further described in the Auditor's Responsibilities for the Audit of the Financial Statements section of our report. We are independent of the Bank in accordance with the Code of Ethics issued by the ICAI together with the ethical requirements that are relevant to our audit of the financial statements, and we have fulfilled our other ethical responsibilities in accordance with these requirements and the Code of Ethics. We believe that the audit evidence we have obtained is sufficient and appropriate to provide a basis for our opinion.

Information Other than the Financial Statements and Auditor's Report Thereon

The Bank's Board of Directors is responsible for the other information. The other information comprises the information in the Board's Report including Annexures to Board's Report but does not include the financial statements and our auditor's report thereon.

Our opinion on the financial statements does not cover the other information and we do not express any form of assurance conclusion thereon.

In connection with our audit of the financial statements, our responsibility is to read the other information and, in doing so, consider whether the other information is materially inconsistent with the financial statements or our knowledge obtained during the course of our audit or otherwise appears to be materially misstated. When we read the other information as specified above, if we conclude that there is a material misstatement therein, we are required to communicate the matter to those charged with governance. We have nothing to report in this regard.

Responsibilities of Management and Those Charged with Governance (TCWG)

The Board of Directors of the Bank is responsible with respect to the preparation of these financial statements that give true and fair view of the financial position and financial performance and cash flow of the Bank in accordance with the accounting principles generally accepted in India, including the Accounting Standards issued by ICAI, and provisions of Banking Regulation Act, 1949, circulars and guidelines issued by the Reserve Bank of India ('RBI') and guidelines issued by Central Registrar of Co-operative Societies from time to time. This responsibility also includes maintenance of adequate accounting records in accordance with the provisions of the Act for safeguarding the assets of the Bank and for preventing and detecting frauds and other irregularities; selection and application of appropriate accounting policies; making judgements and estimate that are reasonable and prudent; and design, implementation and maintenance of adequate internal financial controls, that were operating effectively for ensuring the accuracy and completeness of the accounting records, relevant to the preparation and presentation of the financial statements that give true and fair view and are free from material misstatement, whether due to fraud or error.

In preparing the financial statements, management is responsible for assessing the Bank's ability to continue as a going concern, disclosing, as applicable, matters related to going concern and using the going concern basis of accounting unless management either intends to liquidate the Bank or to cease operations, or has no realistic alternative but to do so.

The Board of Directors are also responsible for overseeing the Bank's financial reporting process.

Auditor's Responsibilities for the audit of the Financial Statements

Our objectives are to obtain reasonable assurance about whether the financial statements as a whole are free from material misstatement, whether due to fraud or error, and to issue an auditor's report that includes our opinion. Reasonable assurance is a high level of assurance but is not a guarantee that an audit conducted in accordance with Standards on Auditing (SAs) will always detect a material misstatement when it exists. Misstatements can arise from fraud or error and are considered material if, individually or in the aggregate, they could reasonably be expected to influence the economic decisions of users taken on the basis of these financial statements.

As part of an audit in accordance with SAs, we exercise professional judgment and maintain professional skepticism throughout the audit. We also:

Identify and assess the risks of material misstatement of the financial statements, whether due to fraud or error, design and perform audit procedures responsive to those risks, and obtain audit evidence that is sufficient and appropriate to provide a basis for our opinion. The risk of not detecting a material misstatement resulting from fraud is higher than for one resulting from error, as fraud may involve collusion, forgery, intentional omissions, misrepresentations, or the override of internal control.

Obtain an understanding of internal control relevant to the audit in order to design procedures that are appropriate in the circumstances but not for the purpose of expressing an opinion on the effectiveness of the entity's internal control.

Evaluate the appropriateness of accounting policies used and the reasonableness of accounting estimates and related disclosures made by management.

Conclude on the appropriateness of management's use of the going concern basis of accounting and, based on the audit evidence obtained, whether a material uncertainty exists related to events or conditions that may cast significant doubt on the Bank's ability to continue as a going concern. If we conclude that a material uncertainty exists, we are required to draw attention in our auditor's report to the related disclosures in the financial statements or, if such disclosures are inadequate, to modify our opinion. Our conclusions are based on the audit evidence obtained up to the date of our auditor's report. However, future events or conditions may cause the Bank to cease to continue as a going concern.



- Evaluate the overall presentation, structure and content of the financial statements, including the disclosures, and whether the financial statements represent the underlying transactions and events in a manner that achieves fair presentation.

We communicate with those charged with governance regarding, among other matters, the planned scope and timing of the audit and significant audit findings, including any significant deficiencies in internal control that we identify during our audit.

We also provide those charged with governance with a statement that we have complied with relevant ethical requirements regarding independence, and to communicate with them all relationships and other matters that may reasonably be thought to bear on our independence, and where applicable, related safeguards. From the matters communicated with those charged with governance, we determine those matters that were of most significance in the audit of the financial statements of the current period and are therefore the key audit matters. We describe these matters in our auditor's report unless law or regulation precludes public disclosure about the matter or when, in extremely rare circumstances, we determine that a matter should not be communicated in our report because the adverse consequences of doing so would reasonably be expected to outweigh the public interest benefits of such communication.

Report on Other Legal and Regulatory Requirements

The Balance Sheet and the Profit and Loss Account have been drawn up in Forms 'A' and 'B' respectively of the Third Schedule to the Banking Regulation Act, 1949, including rules made thereunder.

As required by the Certification/ Reporting requirements to be incorporated in the appointment letter AMD.DOS.MAG, ACG & LEGAL. NO. S439/02-16-028/2022-23 dated 27/07/2022, We give in the Annexure A, statements on the matters as specified, to the extent applicable to the Bank.

As required by the RBI's letter no. DOR.ACC.REC. No.45/21.04.018/2021-22 dated August 31, 2021, We give in the Notes to Accounts section of our report, the disclosures as required, to the extent applicable to the Bank.

We further report that:

- a) We have obtained all the relevant information and explanations, which to the best of our knowledge and belief were necessary for the purpose of our audit and have found them to be satisfactory;
- b) In our opinion, proper books of accounts as required by law have been kept by the Bank, so far as it appears from our examination of those books of accounts;
- c) The transactions of the Bank, which have come to our notice, have been within the powers of the Bank;
- d) The Balance Sheet and Profit and Loss Account as dealt with by this report are in agreement with the books of accounts and the returns;
- e) The Accounting Standards adopted by the Bank are consistent with those laid down by Accounting Principles generally accepted in India, so far as applicable to Banks;

We also report that for the year under Audit, the Bank has been awarded "A" Classification.

For S. F. Tai & Associates

Chartered Accountants

FRN: 114819W

(Shariq Tai)

Partner

M. No.: 162784

Date : _____ Place : Vadodara.

ધી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ૧૯૪૮ (કો-ઓપરેટીવ સોસાયટીને લાગુ)

ત્રીજી શીડ્યુલ
(જુઓ સેક્શન ૨૮)
ફોર્મ "એ"

તારીખ ૩૧-૦૩-૨૦૨૩ ના રોજ પુરા થતા વર્ષનું પાકુ સરવૈયું

૩૧-૦૩-૨૦૨૨ રકમ ₹	ભંડોળ તથા દેવું	રકમ ₹	૩૧-૦૩-૨૦૨૩ રકમ ₹
	૦૧. શેર ભંડોળ		
૫,૦૦,૦૦,૦૦૦.૦૦	૧. અધિકૃત શેર ભંડોળ ૫૦,૦૦,૦૦૦ શેર પ્રત્યેક ₹. ૧૦/- પ્રમાણે		૫,૦૦,૦૦,૦૦૦.૦૦
૩,૧૭,૦૮,૮૪૦.૦૦	૨. ભરપાઈ થયેલ તથા વસુલ આવેલ શેર ભંડોળ ૩૪,૪૬,૩૨૨.૦૦ શેર પ્રત્યેક ₹. ૧૦/- પ્રમાણે તે પૈકી અ. વ્યક્તિઓ તથા અન્ય બ. સહકારી સંસ્થાઓ ક. રાજ્ય સરકારશ્રી	૩,૪૪,૬૩,૨૨૦.૦૦ - -	૩,૪૪,૬૩,૨૨૦.૦૦
	૦૨. રીઝર્વ ફંડ અને અન્ય ફંડસ		૨૬,૭૪,૮૨,૨૨૭.૨૬
૬,૩૬,૫૪,૮૮૩.૩૪	૧. સ્ટેચ્યુટરી રીઝર્વ ફંડ	૬,૬૮,૭૪,૨૮૮.૩૪	
૨,૯૯,૨૭,૮૩૬.૪૪	૨. બિલ્ડીંગ ફંડ	૩,૧૦,૬૧,૮૦૧.૦૮	
૩૫,૫૭,૬૧૫.૦૦	૩. ડીવીડન્ડ ઇક્વીલાઈઝેશન ફંડ	૩૮,૦૫,૦૬૧.૦૦	
૮,૩૬,૦૪,૯૯૭.૬૨	૪. શકમંદ લેણાં ફંડ	૮,૪૬,૧૮,૬૮૨.૬૨	
૮૦,૭૨,૦૪૧.૨૭	૫. મુદતવીતી વ્યાજ અનામત ફંડ	૮૦,૭૨,૦૪૧.૨૭	
૧૨,૦૦,૯૪૩.૬૪	૬. સ્ટાન્ડર્ડ એસેટસ સામે જોગવાઈ	૧૨,૦૦,૯૪૩.૬૪	
૫૩,૭૭,૦૭૦.૦૦	૭. રોકાણો સામે ઘસારા ફંડ	૫૩,૭૭,૦૭૦.૦૦	
૭૦,૦૦,૦૦૦.૦૦	૮. ઇન્વેસ્ટમેન્ટ ફલકયુએશન ફંડ	૮૦,૦૦,૦૦૦.૦૦	
૩,૭૮,૦૮૪.૦૦	૯. જનરલ પ્રોવીઝન રીઝર્વ	૩,૭૮,૦૮૪.૦૦	
	૧૦. અન્ય ફંડસ		
૫૪,૬૬,૦૮૪.૦૦	૧) સ્પેશીયલ રીઝર્વ ફોર NPA u/s 36(1)(viii)	૬૩,૮૬,૦૮૪.૦૦	
૧,૬૫,૭૪,૫૫૫.૦૦	૨) સ્પેશીયલ રીઝર્વ ફોર B&D u/s 36(1)(viiia)-IT	૧,૮૬,૭૪,૫૫૫.૦૦	
૧૮,૭૬,૦૩૬.૫૪	૩) ધર્માદા ફંડ	૧૮,૭૬,૦૩૬.૫૪	
૨,૦૦,૫૬૧.૬૮	૪) ઉજવણી ફંડ	૨,૦૦,૫૬૧.૬૮	
૮૩,૬૯,૫૨૬.૭૭	૫) સામાજિક કલ્યાણનિધી ફંડ	૮૮,૭૩,૫૫૫.૭૭	
૪૧,૫૪,૪૨૭.૦૦	૬) સભાસદ કલ્યાણનિધી ફંડ	૪૬,૫૮,૪૫૬.૦૦	
૨૧,૧૦,૩૦૭.૪૪	૭) સહકાર પ્રચાર ફંડ	૨૨,૩૬,૩૧૪.૪૪	
૨૦,૨૨,૦૨૨.૦૮	૮) ધાર્મિક કામ (ડોનેશન) ફંડ	૧૮,૨૩,૦૩૬.૦૮	
૩૯,૧૨૪.૮૦	૯) સભાસદ માટે ગ્રીફટ	૩૯,૧૨૪.૮૦	
૨૨,૨૬,૪૨૧.૦૦	૧૦) અમદાવાદ અર્બન કો-ઓ ડીપો. સામે ઘસારા ફંડ	૨૨,૨૬,૪૨૧.૦૦	
	૦૩. રાજ્ય મુખ્ય અને ગૌણ ભાગીદારી ફંડ		
	૧. મધ્યસ્થ સહકારી બેંકોના શેર માટે	-	
	૨. ખેતીવિષયક પ્રાથમિક સહકારી મંડળીઓના શેર માટે	-	
	૩. અન્ય મંડળીઓના શેર માટે	-	
	૦૪. થાપણો		૧,૦૭,૭૧,૮૨,૬૬૮.૦૪
૫૧,૪૧,૬૨,૮૬૭.૦૦	૧. બાંધી મુદતની થાપણો	૫૩,૮૯,૧૨,૮૭૧.૦૦	
-	અ. વ્યક્તિઓ	-	
૨,૦૦,૦૦૦.૦૦	બ. મધ્યસ્થ સહકારી બેન્કો	-	
	ક. અન્ય મંડળીઓ	૨,૦૦,૦૦૦.૦૦	
૮૦,૧૯,૮૪,૨૫૪.૬૨	સરવાળો આગળ લઈ ગયા		૧,૩૭,૯૧,૩૮,૧૧૫.૩૦

ધી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ૧૯૪૯ (કો-ઓપરેટીવ સોસાયટીને લાગુ)

ત્રીજી શીડ્યુલ

(યુઓ સેક્શન ૨૯)

ફોર્મ “એ”

તારીખ ૩૧-૦૩-૨૦૨૩ ના રોજ પુરા થતા વર્ષનું પાકુ સરવૈયું

૩૧-૦૩-૨૦૨૨ રકમ ₹	મિલકત તથા લહેણું	રકમ ₹	૩૧-૦૩-૨૦૨૩ રકમ ₹
	૦૧. રોકડ		૩,૬૫,૨૯,૭૬૪.૮૧
૧,૮૧,૦૨,૯૦૦.૦૦	હાથ ઉપર તથા રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, રાજ્ય સહકારી બેન્ક તથા મધ્યસ્થ સહકારી બેન્કોમાં		
૧,૪૦,૦૦,૦૦૦.૦૦	૧. હાથ ઉપરની સિલક	૧,૮૪,૩૭,૦૪૭.૦૦	
૩,૧૧,૦૬૦.૧૭	૨. ચાલુ થાપણો		
૪૩,૪૧,૬૯૦.૫૮	૧. રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા	૨૫,૦૦,૦૦૦.૦૦	
૮૮,૮૨,૧૪૧.૮૭	૨. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા	૧૧,૦૨,૦૭૯.૫૨	
	૩. ગુજરાત સ્ટેટ કો-ઓપ. બેન્ક લિ. (CSGL a/c સહિત)	૬૪,૯૫,૦૫૭.૫૪	
	૪. બરોડા સેન્ટ્રલ કો-ઓપ. બેન્ક લિ.	૭૯,૯૫,૫૮૦.૭૫	
	૦૨. અન્ય બેન્કોમાં સિલક		૧૯,૪૬,૪૧,૯૩૪.૦૧
૭,૬૬,૬૧૨.૭૪	૧. ચાલુ થાપણો		
૧,૪૬,૩૩,૧૫૫.૦૩	૧. બેન્ક ઓફ બરોડા	૧૦,૦૯,૫૭૨.૭૪	
૧,૧૩,૯૧,૫૬૧.૬૭	૨. IDBI બેન્ક (CTS a/c સહિત)	૧,૧૬,૦૭,૧૪૩.૮૩	
૫૫,૬૧૬.૮૬	૩. HDFC બેન્ક	૧,૦૬,૫૨,૨૮૮.૮૨	
૫૧,૦૮,૫૪૫.૦૮	૪. ICICI બેન્ક	૫૫,૬૧૬.૮૬	
-	૫. કોર્પોરેશન બેન્ક (યુનીયન બેંક ઓફ ઈન્ડિયા)	૫૧,૯૯,૮૨૫.૫૮	
	૬. એક્સીસ બેન્ક વચુંઅલ ખાતુ	૬૭,૮૧૯.૦૮	
-	૨. બચત થાપણો	-	
૩,૦૨,૩૦,૫૦૫.૦૦	૩. મુદતી થાપણો		
-	૧. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા	૩,૫૦,૦૦,૦૦૦.૦૦	
૩,૬૫,૦૦,૦૦૦.૦૦	૨. ગુજરાત સ્ટેટ કો-ઓપ. બેન્ક લિ.-અમદાવાદ	૧,૮૦,૦૦,૦૦૦.૦૦	
૨,૯૯,૦૦,૦૦૦.૦૦	૩. બરોડા સેન્ટ્રલ કો-ઓપ. બેન્ક લિ.	૩,૮૦,૦૦,૦૦૦.૦૦	
-	૪. બેન્ક ઓફ બરોડા	૨,૯૯,૦૦,૦૦૦.૦૦	
૩,૪૮,૯૯,૦૦૦.૦૦	૫. આઈ.સી.આઈ.સી.આઈ બેન્ક	-	
૧,૫૦,૦૦,૦૦૦.૦૦	૬. કોર્પોરેશન બેન્ક (યુનીયન બેંક ઓફ ઈન્ડિયા)	૧,૯૯,૦૦,૦૦૦.૦૦	
-	૭. IDBI બેન્ક (ક્લીયરીંગ માટે ઓવરડ્રાફ્ટ સામે તારણમાં આપેલ ₹ ૧.૫૦ કરોડ સહિત)	૧,૫૦,૦૦,૦૦૦.૦૦	
૨૨,૨૬,૪૨૧.૦૦	૮. HDFC બેન્ક	૮૦,૨૩,૨૪૬.૦૦	
	૯. અમદાવાદ અર્બન કો-ઓપ. બેન્ક લિ.-અમદાવાદ	૨૨,૨૬,૪૨૧.૦૦	
-	૦૩. ટુંકી મુદત અને કોલ ડીપોઝીટ ખાતે રકમ		-
૨૨,૬૪,૪૯,૨૧૦.૧૦	સરવાળો આગળ લઈ ગયા		૨૩,૧૧,૭૧,૬૯૮.૮૨

ધી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ૧૯૪૯ (કો-ઓપરેટીવ સોસાયટીને લાગુ)

ત્રીજી શીડ્યુલ

(જુઓ સેક્શન ૨૯)

ફોર્મ “ એ ”

તારીખ ૩૧-૦૩-૨૦૨૩ ના રોજ પુરા થતા વર્ષનું પાકુ સરવૈયું

૩૧-૦૩-૨૦૨૨ રકમ ₹	ભંડોળ તથા દેવું	રકમ ₹	૩૧-૦૩-૨૦૨૩ રકમ ₹
૮૦,૧૮,૮૪,૨૫૪.૬૨	સરવાળો આગળ લાવ્યા		૧,૩૭,૮૧,૩૮,૧૧૫.૩૦
૪૧,૫૩,૨૭,૬૦૩.૨૬	૨. બચત થાપણો	૪૨,૬૪,૧૪,૦૩૮.૧૨	
-	અ. વ્યક્તિઓ	-	
૬,૨૦,૦૮૬.૬૨	બ. મધ્યસ્થ સહકારી બેન્કો	૩૮,૨૬,૩૩૭.૪૪	
	ક. અન્ય મંડળીઓ		
૧૩,૫૩,૪૮,૫૮૬.૩૩	૩. ચાલુ થાપણો	૧૦,૭૫,૬૨,૭૧૮.૧૩	
-	અ. વ્યક્તિઓ	-	
૧૮,૮૮,૫૪૧.૩૧	બ. મધ્યસ્થ સહકારી બેન્કો	-	
	ક. અન્ય મંડળીઓ	૧,૭૬,૭૦૨.૩૫	
-	૪. કોલ મની અને ટુંકી નોટીસની થાપણો		
-	અ. વ્યક્તિઓ	-	
-	બ. મધ્યસ્થ સહકારી બેન્કો	-	
-	ક. અન્ય મંડળીઓ	-	
-	૦૫. કરજ		
-	૧. રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા, રાજ્ય સહકારી બેન્કમાંથી		
-	તથા મધ્યસ્થ સહકારી બેન્કમાંથી		
-	અ) ટુંકી મુદતની લોન, કેશ કેડીટ અને ઓવરડ્રાફ્ટ		
-	જે પૈકી સીકયોર્ડ અગેન્સ		
-	અ. સહકારી અને અન્ય માન્ય જામીનગીરીના તારણ સામે	-	
-	બ. અન્ય વાસ્તવિક જામીનગીરીના તારણ સામે	-	
-	બ) મધ્યમ મુદતની લોન		
-	જે પૈકી સીકયોર્ડ અગેન્સ		
-	અ. સહકારી અને અન્ય માન્ય જામીનગીરીના તારણ સામે	-	
-	બ. અન્ય વાસ્તવિક જામીનગીરીના તારણ સામે	-	
-	ક) લાંબી મુદતની લોન		
-	જે પૈકી સીકયોર્ડ અગેન્સ		
-	અ. સહકારી અને અન્ય માન્ય જામીનગીરીના તારણ સામે	-	
-	બ. અન્ય વાસ્તવિક જામીનગીરીના તારણ સામે	-	
-	૨. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાંથી		
-	અ) ટુંકી મુદતની લોન, કેશ કેડીટ અને ઓવરડ્રાફ્ટ		
-	જે પૈકી સીકયોર્ડ અગેન્સ		
-	અ. સહકારી અને અન્ય માન્ય જામીનગીરીના તારણ સામે	-	
-	બ. અન્ય વાસ્તવિક જામીનગીરીના તારણ સામે	-	
-	બ) મધ્યમ મુદતની લોન		
-	જે પૈકી સીકયોર્ડ અગેન્સ		
-	અ. સહકારી અને અન્ય માન્ય જામીનગીરીના તારણ સામે	-	
-	બ. અન્ય વાસ્તવિક જામીનગીરીના તારણ સામે	-	
૧,૩૫,૫૧,૮૦,૦૮૨.૧૪	સરવાળો આગળ લઈ ગયા		૧,૩૭,૮૧,૩૮,૧૧૫.૩૦

ધી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ૧૯૪૯ (કો-ઓપરેટીવ સોસાયટીને લાગુ)

ત્રીજી શીડ્યુલ
(જુઓ સેક્શન ૨૯)
ફોર્મ “એ”

તારીખ ૩૧-૦૩-૨૦૨૩ ના રોજ પુરા થતા વર્ષનું પાકુ સરવૈયું

૩૧-૦૩-૨૦૨૨ રકમ ₹	મિલકત તથા લહેણું	રકમ ₹	૩૧-૦૩-૨૦૨૩ રકમ ₹
૨૨,૬૪,૪૯,૨૧૦.૧૦	સરવાળો આગળ લાવ્યા		૨૩,૧૧,૭૧,૬૯૮.૮૨
૬૪,૯૧,૧૩,૨૧૫.૨૧	૦૪. રોકાણો	૬૨,૨૩,૦૪,૭૩૭.૦૦	૬૨,૨૩,૦૯,૯૮૭.૦૦
-	૧. મધ્યસ્થ અને રાજ્ય સરકારની જામીનગીરીઓમાં	-	-
૫,૨૫૦.૦૦	અ. દાશનિક કિંમત ₹. ૬૫,૪૮,૩૦,૪૬૬.૦૦	૫,૨૫૦.૦૦	-
-	બ. બજાર કિંમત ₹. ૬૭,૦૯,૬૮,૯૬૪.૦૦	-	-
૪૯,૯૯,૭૫૦.૦૧	૨. અન્ય ટ્રસ્ટી જામીનગીરીઓમાં	-	-
	૩. સહકારી બેન્કના શેરોમાં	-	-
	૪. PSU બોન્ડમાં	-	-
	૫. અન્ય રોકાણો (ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડ - SBI લીકવીડ ગ્રોથ ફંડ)	-	-
	૦૫. રાજ્ય મુખ્ય અને ગૌણ ભાગીદારી		
	ફંડમાંથી રોકાણો		
-	૧. મધ્યસ્થ સહકારી બેન્ક શેર માટે	-	-
-	૨. ખેતી વિષયક પ્રાથમિક સહકારી મંડળીઓના શેર માટે	-	-
-	૩. અન્ય મંડળીઓના શેર માટે	-	-
	૦૬. ધિરાણો		૫૩,૭૭,૧૩,૭૪૫.૮૨
૯૦,૨૯,૩૯૪.૭૮	૧. ટુંકી મુદતની લોન, રોકડ શાખ, ઓવરડ્રાફ્ટ તથા વટાવેલા બીલો	૧,૧૫,૦૧,૧૧૭.૭૯	
૧૭,૬૩,૭૭,૭૭૦.૩૫	જે પૈકી	૧૮,૮૦,૨૫,૨૬૮.૩૭	
૮,૯૫,૦૦૦.૦૦	અ. સરકારી અને માન્ય જામીનગીરીઓના તારણ સામે	૭,૮૦,૦૦૦.૦૦	
	બ. અન્ય વાસ્તવિક જામીનગીરીઓના તારણ સામે		
	ક. જામીન ઉપર		
	ઉપરના (૧) ધિરાણ પૈકી		
	અ. મુદતવીતી ધિરાણ ₹. ૯૮,૭૮,૦૧૬.૦૪		
	બ. અંદાજેલું ડુબતું અને શકમંદ લહેણું ₹. ૪૪,૮૯,૭૯૩.૫૯		
૨,૭૬,૪૪૭.૦૦	૨. મધ્યમ મુદતની લોન	૧,૨૨,૨૦૧.૦૦	
૨૧,૧૩,૬૩,૭૨૨.૧૨	જે પૈકી	૨૧,૮૨,૫૫,૭૦૬.૦૧	
૨,૯૫,૪૦૨.૬૮	અ. સરકારી અને માન્ય જામીનગીરીઓના તારણ સામે	૨,૦૫,૩૪૫.૩૩	
	બ. અન્ય વાસ્તવિક જામીનગીરીઓના તારણ સામે		
	ક. જામીન ઉપર		
	ઉપરના (૨) ધિરાણ પૈકી		
	અ. મુદતવીતી ધિરાણ ₹. ૯૬,૭૫,૧૦૩.૭૨		
	બ. અંદાજેલું ડુબતું અને શકમંદ લહેણું ₹. ૭૦,૧૧,૨૩૭.૫૪		
૧,૨૭,૮૮,૦૫,૧૬૨.૨૫	સરવાળો આગળ લઈ ગયા		૧,૩૯,૧૧,૯૫,૪૩૧.૭૪

ધી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ૧૯૪૯ (કો-ઓપરેટીવ સોસાયટીને લાગુ)

ત્રીજી શીડ્યુલ

(જુઓ સેક્શન ૨૯)

ફોર્મ “એ”

તારીખ ૩૧-૦૩-૨૦૨૩ ના રોજ પુરા થતા વર્ષનું પાકુ સરવૈયું

૩૧-૦૩-૨૦૨૨ રકમ ₹	ભંડોળ તથા દેવું	રકમ ₹	૩૧-૦૩-૨૦૨૩ રકમ ₹
૧,૩૫,૫૧,૮૦,૦૯૨.૧૪	સરવાળો આગળ લાવ્યા		૧,૩૭,૯૧,૩૮,૧૧૫.૩૦
	ક) લાંબી મુદતની લોન		
	જે પૈકી સીકયોર્ડ અગેન્સ		
-	અ. સહકારી અને અન્ય માન્ય જામીનગીરીના તારણ સામે	-	
-	બ. અન્ય વાસ્તવિક જામીનગીરીના તારણ સામે	-	
	૩. રાજ્ય સરકારથી પાસેથી		
	અ) ટુંકી મુદતની લોન, કેશ કેડીટ અને ઓવરડ્રાફ્ટ		
	જે પૈકી સીકયોર્ડ અગેન્સ		
-	અ. સહકારી અને અન્ય માન્ય જામીનગીરીના તારણ સામે	-	
-	બ. અન્ય વાસ્તવિક જામીનગીરીના તારણ સામે	-	
	બ) મધ્યમ મુદતની લોન		
	જે પૈકી સીકયોર્ડ અગેન્સ		
-	અ. સહકારી અને અન્ય માન્ય જામીનગીરીના તારણ સામે	-	
-	બ. અન્ય વાસ્તવિક જામીનગીરીના તારણ સામે	-	
	ક) લાંબી મુદતની લોન		
	જે પૈકી સીકયોર્ડ અગેન્સ		
-	અ. સહકારી અને અન્ય માન્ય જામીનગીરીના તારણ સામે	-	
-	બ. અન્ય વાસ્તવિક જામીનગીરીના તારણ સામે	-	
	૪. અન્ય રીતે મેળવેલ		
-	(સોર્સ અને સીકયોરીટી દર્શાવવા માટે)	-	
-	૦૬. બિલ્સ ફોર કલેક્શન		
	(સામે દર્શાવેલ બિલ્સ રીસીવેબલ પ્રમાણે)		
૫૦૦.૦૦	૦૭. શાખાના હવાલા		
૧,૮૬,૯૫,૯૦૫.૬૬	૦૮. મુદતવીતી વ્યાજ અનામત		૧,૯૫,૦૩,૪૮૨.૬૬
૫૦,૮૭,૧૬૫.૦૦	૦૯. ચુકવવાપાત્ર વ્યાજ		૪૪,૬૬,૩૦૧.૦૦
	૧૦. અન્ય જવાબદારીઓ અને જોગવાઈઓ		૨,૫૫,૮૧,૩૦૯.૮૦
૪૫,૦૦૦.૦૦	૧. કર્મચારી ગ્રેજ્યુઈટી ચુકવવાપાત્ર	૫,૬૪,૦૯૨.૦૦	
-	૨. ચુકવવાપાત્ર પ્રોફેશનલ ટેક્સ	-	
૬૦૫.૦૦	૩. ચુકવવાપાત્ર ઈન્કમેટેક્સ (TDS)	-	
૩૨,૯૩,૬૦૨.૦૦	૪. ડીવીડન્ડ ચુકવવાનું બાકી	૩૯,૭૪,૦૬૫.૦૦	
૫,૭૧૦.૦૦	૫. સન્ડ્રી ક્રેડીટર્સ	૮૪,૧૧૪.૦૦	
૪૩,૩૩૨.૫૩	૬. ડીપોઝીટ અનામત (વ્યક્તિઓ)	૯૨,૮૦૯.૬૮	
૧૪,૩૧,૨૩૪.૯૦	૭. પે-ઓર્ડર(બેન્કર્સ ચેક) /ડી.ડી. ચુકવવાના બાકી	૫૨,૮૭,૨૪૬.૯૦	
૬,૧૪,૬૦૦.૦૦	૮. ચુકવવાપાત્ર બોનસ/એક્સપ્રેસીયા	૫,૭૧,૨૦૦.૦૦	
૨૩,૦૦૦.૦૦	૯. ઉમેદવારી ફી અનામત	૨૩,૦૦૦.૦૦	
૨,૭૬,૦૦૦.૦૦	૧૦. ચુકવવાપાત્ર ઓડીટ ફી / પ્રોફેશનલ ફી	૨,૮૧,૦૦૦.૦૦	
૮૪,૪૫,૨૮૧.૦૦	૧૧. કર્મચારી લીવ એન્કેશમેન્ટ જોગવાઈ (વધુ આગળના પાન પર)	૮૮,૨૫,૫૪૩.૦૦	
૧,૩૯,૩૧,૪૨,૦૨૮.૨૩	સરવાળો આગળ લઈ ગયા		૧,૪૨,૮૬,૮૯,૨૦૮.૭૬

ધી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ૧૯૪૯ (કો-ઓપરેટીવ સોસાયટીને લાગુ)

ત્રીજી શીડ્યુલ
(જુઓ સેક્શન ૨૯)
ફોર્મ “એ”

તારીખ ૩૧-૦૩-૨૦૨૩ ના રોજ પુરા થતા વર્ષનું પાકુ સરવૈયું

૩૧-૦૩-૨૦૨૨ રકમ રૂ	મિલકત તથા લહેણું	રકમ રૂ	૩૧-૦૩-૨૦૨૩ રકમ રૂ
૧,૨૭,૮૮,૦૫,૧૬૨.૨૫	સરવાળો આગળ લાવ્યા		૧,૩૯,૧૧,૮૫,૪૩૧.૭૪
	૩. લાંબી મુદતની લોન		
	જે પૈકી		
	અ. સરકારી અને માન્ય જામીનગીરીઓના તારણ સામે	-	
૮,૩૭,૪૯,૦૫૨.૦૨	બ. અન્ય વાસ્તવિક જામીનગીરીઓના તારણ સામે	૧૧,૮૮,૨૪,૧૦૭.૪૨	
-	ક. જામીન ઉપર	-	
	ઉપરના (૩) ધિરાણ પૈકી		
	અ. મુદતવીતી ધિરાણ રૂ. ૩૪,૮૪,૭૩૭.૮૦		
	બ. અંદાજેલું ડુબતું અને શકમંદ રૂ. ૩૮,૧૪,૫૪૮.૮૦		
	લહેણું		
-	૦૭. મળવાપાત્ર વ્યાજ		૩,૩૯,૧૪,૦૭૨.૬૬
	જે પૈકી		
૧,૮૬,૯૫,૮૦૫.૬૬	અ. મુદતવીતી ધિરાણ વ્યાજ	૧,૮૫,૦૩,૪૮૨.૬૬	
૧,૩૨,૮૦,૬૪૮.૭૨	બ. રોકાણોના વ્યાજની રકમ	૧,૪૪,૧૦,૫૮૦.૦૦	
-	૦૮. બિલ્સ રીસીવેબલ		
	(સામે દર્શાવેલ બિલ્સ ફોર કલેક્શન પ્રમાણે)		
-	૦૯. શાખાના હવાલા		
	૧૦. ઈમારતો		૩૮,૬૬,૮૪૭.૦૦
	૧. જમીન	-	
૪૨,૮૬,૪૮૭.૦૦	૨. મકાન-મિલકત		
	પાછલા વર્ષના સરવૈયા મુજબ	૪૨,૮૬,૪૮૭.૦૦	
	વર્ષ દરમ્યાન થયેલ વધારો	-	
	બાદ: ચાલુ વર્ષનો ઘસારો	૪,૨૯,૬૫૦.૦૦	
	૧૧. રાયરથીલું, જડતર અને અન્ય મિલકત		૬૭,૦૮,૯૮૩.૯૮
૨૦,૮૬,૪૬૬.૭૨	૧. રાયરથીલું અને જડતર		
	પાછલા વર્ષના સરવૈયા મુજબ	૨૦,૮૬,૪૬૬.૭૨	
	વર્ષ દરમ્યાન થયેલ વધારો	૨૨,૬૮,૮૮૮.૨૧	
	બાદ: માંડવાળ (Write Off)	૭૭,૬૦૦.૦૦	
	બાદ: ચાલુ વર્ષનો ઘસારો	૪,૧૬,૦૫૩.૯૫	
૯,૭૧,૧૪૫.૦૦	૨. સેફ ડીપોઝીટ વોલ્ટ		
	પાછલા વર્ષના સરવૈયા મુજબ	૯,૭૧,૧૪૫.૦૦	
	વર્ષ દરમ્યાન થયેલ વધારો	-	
	બાદ: ચાલુ વર્ષનો ઘસારો	૯૭,૧૧૫.૦૦	
૩,૫૦,૭૧૦.૦૦	૩. કોમ્પ્યુટર સાધનો		
	પાછલા વર્ષના સરવૈયા મુજબ	૩,૫૦,૭૧૦.૦૦	
	વર્ષ દરમ્યાન થયેલ વધારો	૧૧,૩૧,૦૦૦.૦૦	
	બાદ: માંડવાળ (Write Off)	૨,૯૫૦.૦૦	
	બાદ: ચાલુ વર્ષનો ઘસારો	૪,૪૩,૫૪૧.૦૦	
૧,૪૦,૨૨,૩૫,૫૮૭.૩૭	સરવાળો આગળ લઈ ગયા		૧,૪૩,૫૬,૮૫,૩૪૫.૩૮

ધી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ૧૯૪૯ (કો-ઓપરેટીવ સોસાયટીને લાગુ)

ત્રીજુ શીડ્યુલ
(જુઓ સેક્શન ૨૯)
ફોર્મ “એ”

તારીખ ૩૧-૦૩-૨૦૨૩ ના રોજ પુરા થતા વર્ષનું પાકુ સરવૈયું

૩૧-૦૩-૨૦૨૨ રકમ રૂ	ભંડોળ તથા દેવું	રકમ રૂ	૩૧-૦૩-૨૦૨૩ રકમ રૂ
૧,૩૯,૩૧,૪૨,૦૨૮.૨૩	સરવાળો આગળ લાવ્યા		૧,૪૨,૮૬,૮૮,૨૦૮.૭૬
૨,૬૪,૫૦,૦૦૦.૦૦	૧૦. અન્ય જવાબદારીઓ અને જોગવાઈઓ (પાછળના પાનથી ચાલુ)		
૫,૦૫૫.૦૦	૧૨. ઇન્કમેટેક્સ જોગવાઈ	૫૭,૦૦,૦૦૦.૦૦	
૬૫,૦૦૦.૦૦	૧૩. સ્થિતિયોરીટી ડીપોઝીટ / લોન ડીપોઝીટ અનામત	૫,૦૫૫.૦૦	
૭૮,૫૨૦.૦૦	૧૫. ખર્ચની જોગવાઈ	૮૭,૦૦૦.૦૦	
-	૧૬. રોકડ વધ-ઘટ ખાતે	૬૩,૮૮૦.૦૦	
૧,૨૪,૧૩૭.૮૧	૧૮. ચુકવવાપાત્ર વકીલ ફી	૧,૬૦૦.૦૦	
-	૧૮. ચુકવવાપાત્ર CGST/SGST/IGST	૧૦,૫૦૪.૨૨	
	૧૮. ચુકવવાપાત્ર શિક્ષણ ફાળો (જીલ્લા સહકારી સંઘ)	-	
૧,૨૬,૭૧,૦૬૧.૬૪	૧૧. નફા નુકશાન ખાતે		૧,૬૩,૮૪,૨૫૮.૧૮
	પાછલા સરવૈયા મુજબ નફો	૧,૨૬,૭૧,૦૬૧.૬૪	
	બાદ : વહેંચણી	૧,૨૬,૭૧,૦૬૧.૬૪	
		૦.૦૦	
	ઉમેરો : નફા-નુકશાન ખાતેથી મેળવેલ ચાલુ સાલનો નફો	૧,૬૩,૮૪,૨૫૮.૧૮	
	૧૨. આકસ્મિક જવાબદારીઓ		
	૧. ગેરંટી ઇસ્યુડ(નાણાંકીય)	૩,૦૦,૦૦૦.૦૦	
	(પાછલા વર્ષની રકમ રૂ. ૨,૦૦,૦૦૦.૦૦)		
	૨. અન્ય-દાવા ન કરેલ ખાતા (ડીફ સ્કીમ-૨૦૧૪ ખાતે ટ્રાન્સફર)	૧,૬૪,૮૦,૨૮૦.૩૪	
	(પાછલા વર્ષની રકમ રૂ. ૧,૫૮,૩૭,૦૮૭.૬૪)		
૧,૪૩,૨૫,૩૫,૮૦૨.૬૮	કુલ સરવાળો		૧,૪૪,૫૦,૮૩,૪૬૭.૯૪

અમારા આજિંદાના ઓડીટ મેમો ભાગ-૧ અને ભાગ-૨ ના સામાન્ય શેરોને આધિન તપાસેલ છે અને બરાબર માલુમ પડેલ છે.

એસ.એફ. તાઈ એન્ડ એસોસીએટસ

ચાર્ટડ એકાઉન્ટન્ટસ

નોંધણી : ૧૧૪૮૧૯W

સીએ શારીક તાઈ

(પાર્ટનર)

સર્ટીફાઈડ ઓડીટર

મેમ્બરશીપ નંબર : ૧૬૨૭૮૪

આર.બી.આઈ. યુનિક કોડ : Q૧૨૩૬૨૦

વડોદરા

તારીખ: ૩૦/૦૬/૨૦૨૩

સીએ ઇલૈયા એ. સુરતી

જનરલ મેનેજર ઇન્ચાર્જ

નાઝીયા એમ. સીરીવાલા

એકાઉન્ટન્ટ

ધી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ૧૯૪૯ (કો-ઓપરેટીવ સોસાયટીને લાગુ)

ત્રીજી શીડ્યુલ
(જુઓ સેક્શન ૨૮)
ફોર્મ “એ”

તારીખ ૩૧-૦૩-૨૦૨૩ ના રોજ પુરા થતા વર્ષનું પાકુ સરવૈયું

૩૧-૦૩-૨૦૨૨ રકમ રૂ	મિલકત તથા લહેણું	રકમ રૂ	૩૧-૦૩-૨૦૨૩ રકમ રૂ
૧,૪૦,૨૨,૩૫,૫૮૭.૩૭	સરવાળો આગળ લાવ્યા		૧,૪૩,૫૬,૮૫,૩૪૫.૩૮
૧૩,૧૮,૫૫૮.૦૦	૪. બેન્ક બીકલ, લીફ્ટ, ઈલેક્ટ્રીફિકેશન અને સોલર સીસ્ટમ	૧૩,૧૮,૫૫૮.૦૦	
	પાછલા વર્ષના સરવૈયા મુજબ	-	
	વર્ષ દરમ્યાન થયેલ વધારો	-	
	બાદ: માંડવાળ (Write Off)	-	
	બાદ: ચાલુ વર્ષનો ઘસારો	૩,૮૧,૬૧૫.૦૦	
	૧૨. અન્ય અસ્કયામતો		૮૩,૮૮,૧૨૨.૫૬
૮,૭૦,૫૮૮.૧૧	૧. સ્ટેશનરી / પ્રિન્ટીંગ સ્ટોક	૧૧,૪૪,૫૮૧.૧૧	
૧૩,૮૪૫.૦૦	૨. કરાર સ્ટેમ્પ હાથ ઉપર	૨૭,૬૮૫.૦૦	
-	૩. અલવી કો-ઓપ. બેંક કર્મચારી ગ્રેજ્યુઇટી ફંડ ટ્રસ્ટ	-	
૫૮,૨૧૫.૦૦	૪. ટેલીફોન / એમ.જી.વી.સી.એલ ડીપોઝીટ	૫૮,૨૧૫.૦૦	
-	૫. લીફ્ટ પેટે એડવાન્સ (હેડ ઓફીસ)	-	
૧૭,૪૨૭.૧૮	૬. DEAF (દાવા ન કરેલ ખાતા) RBI પાસેથી મળવાપાત્ર રકમ	૧૩,૭૩૨.૬૨	
૩૮,૧૨૪.૮૦	૭. ચાંદીના ગીફ્ટ આર્ટીકલ	૩૮,૧૨૪.૮૦	
૧૨,૦૨,૧૪૮.૦૦	૮. TDS (બોન્ડ/બેન્ક મુદતી થાપણોના વ્યાજ પર)	૩,૩૮,૦૭૧.૦૦	
૨,૬૫,૬૧,૬૮૦.૦૦	૯. એડવાન્સ ઈન્કમેટેક્સ	૭૫,૧૩,૮૨૮.૦૦	
૮૩,૮૦૬.૨૧	૧૦. મળવાપાત્ર GST-CGST/SGST/IGST	૧,૧૫,૬૪૩.૦૩	
૫૮,૮૪૨.૦૦	૧૧. ડીફર્ડ ટેક્સ એસેટ્સ	૭૨,૫૬૨.૦૦	
૭૨,૬૬૮.૦૦	૧૨. અ.બ.યો. સન્ડ્રી (મળવાપાત્ર કોર્ટ રકમ)	૭૨,૬૬૮.૦૦	
	- ૧૩. દાવાઓ પેટે પ્રાપ્ત કરેલ અસ્કયામતો		-
	- ૧૪. નફા નુકશાન ખાતે		-
૧,૪૩,૨૫,૩૫,૮૦૨.૬૮	કુલ સરવાળો		૧,૪૪,૫૦,૮૩,૪૬૭.૮૪

શબ્દીરહુસેન મુનવ્વરઅલી મોટરવાલા
ચેરમેન

ઝાકીરહુસેન ફખરુદ્દીન મરયાવાલા
મેનેજિંગ ડીરેક્ટર

તાલીબ સુલેમાન દવાવાલા
જોઈન્ટ મેનેજિંગ ડીરેક્ટર

: ડીરેક્ટર્સ :

સીએ હાજી અકબર ઝકરીયાભાઈ ચશમાવાલા (પ્રોફેશનલ ડીરેક્ટર)

ઈબ્રાહીમ ઈમાદુદ્દીન બોરા (એડવોકેટ નોટરી) (પ્રોફેશનલ ડીરેક્ટર)

આમેનાબેન હેદરઅલી બુકબાઈન્ડર

મઝહરઅલી ઈશાકઅલી ચીનવાલા

સારાબેન અલીભાઈ દરજી

તૈયબઅલી જીવાભાઈ ધર્મજીવાલા

યુનુસઅલી બગસભાઈ પટેલ

અસગરી અલીહુસેન ઠાકરાવાલા



ધી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ૧૯૪૯ (કો-ઓપરેટીવ સોસાયટીને લાગુ)

ત્રીજી શીડ્યુલ
(જુઓ સેક્શન ૨૯)
ફોર્મ “બી”

તારીખ ૩૧-૦૩-૨૦૨૩ ના રોજ પુરા થતા વર્ષનું નફા-નુકશાન ખાતું

૩૧-૦૩-૨૦૨૨	ખર્ચ	રકમ રૂ	૩૧-૦૩-૨૦૨૩
૫,૭૫,૪૬,૯૨૮.૬૭	૦૧. થાપણો, કરજો વિગેરે ઉપરનું વ્યાજ		૫,૭૪,૦૦,૨૪૩.૮૭
૨,૬૬,૮૫,૩૨૦.૦૦	૦૨. પગાર, ભથ્થા, પ્રોવિડન્ટ ફંડ, બોનસ વિગેરે		૨,૪૪,૮૪,૭૨૬.૦૦
૫,૦૭,૫૦૦.૦૦	૦૩. ડાયરેક્ટર્સ તથા સ્થાનિક સમિતિના સભ્યોની ફી તથા ભથ્થા		૪,૮૯,૯૧૫.૦૦
૨૭,૭૭,૦૯૧.૦૦	૦૪. ભાડુ, કર, વિમો, વિજળી વિગેરે		૨૮,૧૩,૩૬૪.૬૭
૧,૮૭,૮૫૦.૦૦	૦૫. કાનુની ખર્ચ		૫,૬૮,૬૦૦.૦૦
૧,૦૬,૭૭૩.૧૬	૦૬. તાર, ટપાલ અને ટેલીફોન ખર્ચ		૯૮,૬૧૩.૦૦
૨,૨૭,૦૦૦.૦૦	૦૭. ઓડીટ ફી		૨,૩૯,૦૦૦.૦૦
૧૫,૩૭,૭૮૫.૫૦	૦૮. મિલકત મરામત અને ઘસારા ખર્ચ		૨૨,૩૮,૨૦૫.૭૫
૩,૦૩,૨૨૫.૧૪	૦૯. સ્ટેશનરી, છાપકામ અને જાહેરાત ખર્ચ		૧,૯૦,૮૧૪.૪૩
-	૧૦. બીન બેન્કીંગ અસ્કયામતોના વેચાણ અગર લેવડ-દેવડમાં આવેલી ખોટ		-
૫૦,૩૬,૪૯૨.૧૩	૧૧. અન્ય ખર્ચ (પરિશિષ્ટ-૧)		૪૯,૨૬,૭૩૯.૫૩
-	૧૨. માંડવાળ (ડેડ સ્ટોક Write Off)		-
	૧૩. જોગવાઈ		૯૭,૧૫,૪૧૬.૦૦
૧૭,૫૦,૦૦૦.૦૦	૧. સ્પેશીયલ રીઝર્વ ફોર B&D u/s 36(1)(viii)	૨૧,૦૦,૦૦૦.૦૦	
૮,૫૦,૦૦૦.૦૦	૨. સ્પેશીયલ રીઝર્વ ફોર NPA u/s 36(1)(viii)	૯,૨૦,૦૦૦.૦૦	
૪૭,૦૦,૦૦૦.૦૦	૩. ઇન્કમેટેક્સ જોગવાઈ	૫૭,૦૦,૦૦૦.૦૦	
૬,૭૮,૮૪૪.૦૦	૪. સ્ટાફ લીવ એનકેશમેન્ટ જોગવાઈ	૧૦,૦૮,૦૩૬.૦૦	
૭,૮૭૨.૦૦	૫. ડીફર્ડ ટેક્સ જોગવાઈ (NET)	-૧૨,૬૨૦.૦૦	
-	૧૪. RBI પેનલ્ટી		-
૧,૨૬,૭૧,૦૬૧.૬૪	૧૫. ચોખ્ખો નફો (સરવૈયા ખાતે લઈ ગયા)		૧,૬૩,૯૪,૨૫૯.૧૮
૧૧,૫૫,૮૩,૭૪૩.૨૪	કુલ સરવાળો		૧૧,૮૫,૫૯,૮૯૭.૪૩

અમારા આજદિનના ઓડીટ મેમો ભાગ-૧ તથા ભાગ-૨ ના સામાન્ય શેરાને આધિન તપાસેલ છે અને બરાબર માલુમ પડેલ છે.

એસ.એફ. તાઈ એન્ડ એસોસીએટસ

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ

નોંધણી : ૧૧૪૮૧૯W

સીએ શારીક તાઈ

(પાર્ટનર)

સર્ટીફાઈડ ઓડીટર

મેમ્બરશીપ નંબર : ૧૬૨૭૮૪, આર.બી.આઈ. યુનિક કોડ : ૦૧૨૩૬૨૦

વડોદરા.

તારીખ: ૩૦/૦૬/૨૦૨૩

સીએ ઇલૈયા એ. સુરતી

જનરલ મેનેજર ઇન્ચાર્જ

નાઝીયા મઝાહીર સીરીવાલા

એકાઉન્ટન્ટ

ધી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ૧૯૪૯ (કો-ઓપરેટીવ સોસાયટીને લાગુ)

ત્રીજુ શીડ્યુલ
(જુઓ સેક્શન ૨૮)
ફોર્મ “ બી ”

તારીખ ૩૧-૦૩-૨૦૨૩ ના રોજ પુરા થતા વર્ષનું નફા-નુકશાન ખાતું

૩૧-૦૩-૨૦૨૨	આવક	રકમ ₹	૩૧-૦૩-૨૦૨૩
૧૧,૦૦,૪૭,૪૭૯.૫૧	૦૧. વ્યાજ અને વટાવ		૧૧,૩૯,૮૮,૯૪૫.૨૭
૧૨,૪૩,૫૭૨.૩૯	૦૨. કમીશન, એક્સચેન્જ અને દલાલી		૯,૬૯,૪૬૮.૮૮
-	૦૩. સહાય અને દાન		-
૩૫,૫૩૯.૭૩	૦૪. બીન બેન્કીંગ અસ્કયામતોમાંથી આવક અને આવી અસ્કયામતોના વેચાણમાંથી થયેલો નફો		૮૩,૪૯૫.૦૬
૪૨,૫૭,૧૫૧.૬૧	૦૫. અન્ય આવક (પરિશિષ્ટ-૨)		૪૫,૧૭,૯૮૮.૨૨
-	૦૬. નુકશાન (જો કોઈપણ)		-
૧૧,૫૫,૮૩,૭૪૩.૨૪	કુલ સરવાળો		૧૧,૮૫,૫૯,૮૯૭.૪૩

શબ્દીરહુસેન મુનવ્વરઅલી મોટરવાલા
ચેરમેન

ઝાકીરહુસેન ફખરુદ્દીન મરયાવાલા
મેનેજિંગ ડીરેક્ટર

તાલીબ સુલેમાન દવાવાલા
જોઈન્ટ મેનેજિંગ ડીરેક્ટર

: ડીરેક્ટર્સ :

સીએ હાજી અકબર ઝકરીયાભાઈ ચશમાવાલા (પ્રોફેશનલ ડીરેક્ટર)
ઈબ્રાહીમ ઈમાદુદ્દીન વ્હોરા (એડવોકેટ નોટરી) (પ્રોફેશનલ ડીરેક્ટર)
આમેનાબેન હેદરઅલી બુકબાઈન્ડર
મઝહરઅલી ઈશાકઅલી ચીનવાલા
સારાબેન અલીભાઈ દરજી
તેયબઅલી જીવાભાઈ ધર્મજવાલા
યુનુસઅલી બગસભાઈ પટેલ
અસગરી અલીહુસેન ઠાકરાવાલા

પરિશિષ્ટ - ૧
અન્ય ખર્ચ (નફા-નુકશાન ખાતું)

૩૧-૦૩-૨૦૨૨	વિગત	૩૧-૦૩-૨૦૨૩
૧૨,૮૬૪.૦૦	પરચૂરણ ખર્ચ	-
૨,૪૨,૩૪૬.૬૮	ઓફીસ ખર્ચ	૩,૩૪,૮૫૫.૮૫
૧,૩૧,૭૮૫.૦૦	કન્વેયન્સ / ટ્રાવેલીંગ ખર્ચ	૧,૩૨,૩૮૨.૦૦
૩,૬૮,૫૬૫.૪૨	એન્ટરટેઇનમેન્ટ ખર્ચ	૧,૮૪,૭૯૧.૨૮
૬,૮૫૧.૦૦	ધાર્મિક ખર્ચ	૫૫,૭૫૧.૦૦
૧,૯૮,૫૧૦.૦૦	વાર્ષિક સાધારણ સભા ખર્ચ	૬,૮૨,૧૮૮.૮૮
૪,૬૦,૨૬૭.૦૦	સીક્યોરીટી ખર્ચ	૪,૬૩,૮૬૨.૦૦
૫,૦૧૫.૦૦	લાઈબ્રેરી ખર્ચ	૭,૫૬૮.૦૦
૩૪,૮૮૮.૩૦	ડોનેશન ખર્ચ	૪,૦૦૦.૦૦
૧,૮૩,૧૩૩.૪૧	કોમ્પ્યુટર ખર્ચ	૨,૦૭,૮૮૮.૩૪
૧,૨૬,૧૫૮.૦૦	પ્રોવિડન્ડ ફંડ વહીવટી ખર્ચ	૧,૨૪,૮૪૨.૦૦
-	ચૂંટણી ખર્ચ	-
૧૮,૮૦,૦૦૦.૦૦	સભાસદ મરણોત્તર સહાય ખર્ચ	૧૧,૨૫,૦૦૦.૦૦
૬,૦૭,૮૮૮.૫૫	વાર્ષિક મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ ખર્ચ	૬,૩૦,૪૦૫.૨૫
-	ઓળખપત્ર / રીકવરી / પ્રોસેસ ખર્ચ	૭૭૫.૦૦
૮૧,૦૬૧.૨૦	મેમ્બર્સ ફી (ફેડરેશન / ક્લીયરીંગ હાઉસ)	૭૮,૦૬૮.૧૭
૫૩,૨૭૩.૦૦	GOI સિક્યોરીટી પ્રિમીયમ અમોરટાઇઝેશન (માંડવાળ)	૫૩,૨૭૩.૦૦
૧૧૩,૩૧૫.૮૨	રીપેરીંગ ખર્ચ	૩,૮૭,૭૬૮.૦૬
૩,૧૧,૬૬૮.૬૫	જીએસટી આઈટીસી રીવર્સલ	૪,૪૨,૦૮૮.૫૮
૧,૦૬,૮૮૮.૦૦	સર્વિસ ટેક્સ એસેસમેન્ટ ડયુઝ	-
૫૦,૩૬,૪૮૨.૧૩	સરવાળો	૪૮,૨૬,૭૩૮.૫૩

પરિશિષ્ટ - ૨
અન્ય આવક (નફા-નુકશાન ખાતું)

૩૧-૦૩-૨૦૨૨	વિગત	૩૧-૦૩-૨૦૨૩
-	ડીવીડન્ડ આવક	-
૨૪,૬૬૮.૮૧	લેજર ચાર્જસ	૨૧,૪૫૬.૫૬
૫૮,૪૪૨.૧૭	ફોર્મ વેચાણ ફી	૫૫,૦૦૭.૭૩
૧,૧૭,૮૪૦.૦૦	કસ્ટડી ચાર્જસ	૧,૧૮,૮૦૦.૦૦
૮૧,૭૦૦.૦૦	સર્વિસ ચાર્જસ	૮૩,૮૦૦.૦૦
૧૮,૪૨,૨૦૦.૦૦	લોકર ભાડા આવક	૨૧,૬૮,૦૦૦.૦૦
૬૫,૫૬૪.૮૦	પરચૂરણ આવક	૧,૨૫,૧૩૨.૦૦
૧૨,૭૮,૮૧૪.૮૩	ઈન્સીડેન્શીયલ ચાર્જસ	૧૨,૮૧,૧૨૫.૧૩
૩,૬૭,૩૬૩.૮૦	ચેકબુક ચાર્જસ	૩,૫૪,૪૮૮.૪૦
૨,૦૪,૧૮૦.૦૦	ડોક્યુમેન્ટ પ્રોસેસ ચાર્જસ	૨,૬૨,૫૨૫.૦૦
૧,૧૩,૩૬૬.૦૦	પોસ્ટેજ / આઈ કાર્ડ ચાર્જસ	૪૭,૪૫૨.૪૦
-	ઈન્કમેટેક્સ એડજસ્ટમેન્ટ ખાતે	-
-	ઈન્કમેટેક્સ રીફંડ	-
-	જી.એસ.ટી. (બિન-પ્રાપ્ત જમા)	-
૧,૮૧૦.૦૦	ઓળખપત્ર આવક	-
૪૨,૫૭,૧૫૧.૬૧	સરવાળો	૪૫,૧૭,૮૮૮.૨૨

SIGNIFICANT ACCOUNTING POLICIES AND NOTES FORMING PART OF ACCOUNTS FOR THE YEAR ENDED MARCH 31, 2023**ACCOUNTING POLICIES****1. Accounting Convention:**

The financial statements have been prepared and presented under the historical cost convention on accrual basis of accounting, and comply with the generally accepted accounting principles, statutory requirements prescribed under the Banking Regulation Act, 1949, and The Gujarat Co-operative Societies Act (the Act), the circulars and guidelines issued by the Reserve Bank of India (RBI) from time to time and the Accounting Standards issued by the Institute of Chartered Accountants of India to the extent applicable and current practices prevailing within the Co-operative Banking industry in India.

Use of estimates:

The preparation of the financial statements in conformity with the generally accepted accounting principles requires the Management of the Bank to make estimates and assumptions that affect the reported amount of assets and liabilities, revenues and expenses and disclosure of contingent liabilities at the date of the financial statements. Actual results could differ from those estimates. The Management believes that the estimates used in the preparation of the financial statements are prudent and reasonable. Any revision to the accounting estimates is recognized prospectively in the current and future periods.

2. Investments:

- Investment portfolio of the Bank is categorized in accordance with the guidelines issued by RBI as under:
 - (a) 'Held to Maturity' comprising investments acquired with the intention to hold them till maturity.
 - (b) 'Held for Trading' comprising investments acquired with the intention to trade within 90 days.
 - (c) 'Available for Sale' comprising investments not covered under (a) and (b) above ie. those which are acquired neither for trading purposes nor for being held till maturity.
- For presentation in the Balance Sheet, Investments are classified under Government Securities, Other Approved Securities, Shares, Bonds of PSU and Other Investments (Bonds of Private sector and other All India Financial Institutions, Commercial Papers and Mutual Funds).
- Valuation of Investments is as per directives issued by RBI from time to time.
- Investments in 'Available for Sale' & 'Held for Trading' categories are valued scrip-wise at lower of cost or market value. Appreciation / Depreciation are aggregated for each class of securities and net depreciation, in aggregate for each category, is provided under Investment Depreciation Reserve, while net appreciation, if any, is ignored.
- Investments in 'Held to Maturity' category are valued at cost and the premium paid in individual security is amortized over the life of that security.
- Market value is taken on the basis of the Yield to Maturity as indicated by Financial Benchmark India Private Ltd (FBIL) and Fixed Income Money Market and Derivatives Association of India (FIMMDA).
- Broken period interest accrued at the time of acquisition of securities is recognized as expenses.
- Income from Government Securities/ Bonds of Public Sector Undertakings and All India Financial Institutions, where interest rates on the instruments are predetermined, income is booked on accrual basis, provided interest is serviced regularly and is not in arrears.
- Income on units of Mutual Funds is booked on cash basis and not on accrual basis. - Investments where principal / interest remain overdue for more than 90 days are classified as Non-Performing and provision is made in line with the guidelines of RBI.

3. Statutory Reserve Fund:

The Reserve Fund is separately invested in Government securities and/ or in fixed deposits with the District Central Co-operative Bank or the State Co-operative Bank or with any other Bank and as permitted by the Reserve Bank of India. Interest accruing thereon shall form part of the general revenue.

4. **Advances:**

In terms of guidelines issued by RBI, advances to borrowers are classified into "Performing" or Non-performing" assets based on recovery of Principal / Interest. Non-Performing Assets (NPA) are further classified as sub- standard, doubtful and loss assets and provisions thereon are made in accordance with the prudential norms prescribed by the RBI.

Specific provisions in respect of NPAs are made subject to the minimum provisioning norms prescribed by the RBI. The Bank also makes additional provisioning over and above the specific minimum provisioning as per RBI norms as a matter of prudence. Provision on Standard Advances is made at a rate ranging between 0.25% and 1.00% as prescribed by RBI.

Overdue Interest Reserve represents unrecovered interest on all NPA Advances & Investments, which is correspondingly shown under Interest Receivable.

5. **Fixed Assets & Depreciation:**

Premises and other Fixed Assets are stated at historical cost, net of accumulated depreciation, thereon. Cost includes cost of purchase and all expenditure like freight, duties, taxes and incidental expenses related to the acquisition and installation of the asset.

Bank has not re-valued any of its Fixed Assets during the year.

Depreciation:

Assets purchased and put to use are depreciated on Written Down Value method as under, except for Computers & Peripherals (Straight Line Method) as directed by RBI:

- (a) Building - 10.00%
- (b) Furniture & Fixtures - 10.00%
- (c) Safe Deposit Vault - 10.00%
- (d) Vehicles - 15.00%
- (e) Electrification - 10.00%
- (f) Lift - 10.00%
- (g) Computer & Peripherals - 33.33% SLM
- (h) Dead Stock - 10.00%

Depreciation on additions to assets is provided for the full year if the assets are purchased on or before 30th September and for the half year, if the assets are purchased after 30th September. No depreciation is provided on assets sold/disposed off during each of the half year.

6. **Revenue Recognition:**

Items of Income and Expenditure are accounted for on accrual basis except for certain items of Income mentioned below, which are accounted for on cash basis:

- (a) Interest on Non-Performing Assets in accordance with RBI guidelines
- (b) Rent on Safe Deposit Lockers
- (c) Interest on Refund of Income Tax, if any.
- (d) Dividend on shares of Co-operative Banks.

7. **Employee Benefits:**

Provident Fund is Defined Contribution Plan and contributions made to the Commissioner of Provident Fund at the prescribed rates are accounted for on accrual basis and deposited within the stipulated time.

The Bank operates defined benefit plan for its employees, viz. gratuity liability. The cost of providing benefits under this plan is determined on the basis of actuarial valuation at each year-end. The Bank is maintaining fund under Trust Deed with Life Insurance Corporation of India (LIC) for gratuity payments to employees and annual premium is paid based on the demand from LIC.

Provision for Leave Encashment is made on an actuarial basis.

8. Related Party Disclosure:

There are no related parties which require a disclosure under AS 18 other than the Key Management Personnel. The Managing Director of the Bank is a single party under the category Key Management Personnel, no further details need to be disclosed in terms of RBI circular dated 29th March, 2003.

9. Earnings Per Share

Basic earnings per share is calculated by dividing the net profit or loss for the year attributable to equity shareholders by the closing number of equity shares outstanding for the year. Earnings considered in ascertaining the Bank's earnings per share is the net profit for the year before appropriation of net profit.

10. Taxes on Income

Provision for current tax is made after taking into consideration benefits admissible under the provisions of the Income-Tax Act, 1961. A Deferred Tax Asset / Liability resulting from timing differences between taxable and accounting income is accounted for, using the tax rates and laws that are enacted as on the Balance Sheet date. A deferred tax asset/ liability is recognized and carried forward only to the extent that there is a reasonable certainty that the asset will be realized in future.

11. Impairment of Assets

The carrying amounts of the Bank's tangible & intangible assets are reviewed at each balance sheet date to determine whether there is any indication of impairment. If any such indication exists, the asset's recoverable amounts are estimated in order to determine the extent of impairment loss, if any. An impairment loss is recognized whenever the carrying amount of an asset exceeds its recoverable amount. The impairment loss, if any, is recognized in the Statement of Profit and Loss in the period in which impairment takes place.

12. Provisions & Contingencies

In conformity with AS- 29 relating to "Provisions, Contingent Liabilities and Contingent Assets", the Bank recognizes by way of provision only when it has a present obligation as a result of past event. It is probable that an outflow of resources embodying economic benefits may be required to settle the obligations as and when a reliable estimate of the amount of the obligation can be made.

Acceptance, endorsements and other obligations including guarantees are disclosed as Contingent Liabilities at the face value of the commitments undertaken.

NOTES TO ACCOUNTS:

1. The Bank has achieved the overall exposure of advances to Priority Sector and Weaker sections as per RBI guidelines.
2. The Bank is maintaining minimum CRAR of 9% on a continuous basis and is exempted from implementing share linkage on advances. However, it has fully implemented the percentage of share linkage during the year.
3. The Bank is primarily engaged in banking activity as defined by RBI. As Interest Income accounts for nearly 94.70% of the bank's total revenue, separate business segment reporting as per AS 17 is not considered necessary.
4. The Bank has provided for Deferred Tax Assets amounting to ₹ 7,872/- on account of timing difference of depreciation of ₹ 31,277/-
5. The Bank has made a provision of ₹ 5,64,092/- as annual premium for LIC Group Gratuity Cash Accumulation Plan.
6. Staff Leave Encashment with respect to retirement benefit is provided for a maximum period of 180 days of paid leave amounting to ₹10,08,036/- for the current year. Total liability towards Leave Encashment upto 31/03/2023 amounts to ₹ 88,25,543/-.
7. The Bank has prepared Cash Flow Statement as per AS-3 by direct method.
8. The Bank has made a provision for current year income tax amounting to ₹ 57.00 lacs computed as per Total Taxable Income as per the Income Tax Act, 1961 after taking into account available deductions and exemptions.

9. The disclosure relating to Contingent Liabilities is as follows:

Particulars	Amount ₹
Bank Guarantees issued on behalf of Constituents	3,00,000
LCs issued	Nil
DEAF Account Amount Transferred to DEAF Scheme	8,55,344

10. The Bank has granted fund-based advances to the Director's & their relatives amounting to ₹ 2.04 lacs against FDs during the year. Such advances are exempted from the purview of RBI Master Circular dated July 1, 2015.

11. In accordance with master circular on investment issued by RBI, Investment Fluctuation Reserve has to be built at 5% of the investment in Available for Sale (AFS) category, subject to availability of net profit.

Amount ₹

Particulars	31/03/2023	31/03/2022
Investment in Available for sale category	46,86,88,455	50,04,43,410
Investment Fluctuation Reserve at 5% of above	2,34,34,423	2,50,22,171
Investment Fluctuation Reserve held by Bank	90,00,000	70,00,000

12. The requirement of provision against Standard & Non-Performing Advances in terms of RBI guidelines are as follows:

Amount in ₹ lakhs

Particulars	31/03/2023			31/03/2022		
	Provision required	Provision Held	Excess Provision	Provision required	Provision Held	Excess Provision
Standard Assets	19.98	15.79	-	11.20	15.79	4.59
Non-Performing Assets	190.70	1090.77	900.07	178.00	1071.43	893.43

The Bank has made excess provision @ 5 times the required provision for NPAs for the current year.

13. Accounting Standard 18 - Related Party Transactions

There are no Related Parties requiring a disclosure under Accounting Standard 18 issued by the ICAI read with Master Circular on Disclosure in Financial Statements – Notes to Accounts dated July 1, 2014 issued by RBI, other than one Key Management Personnel viz. Mr. Zakirhussain F. Marchwala the Managing Director & CEO of the Bank with effect from 20/08/2018. However, in terms of RBI circular dated March 29, 2003, the Managing Director being single party under the category Key Management Personnel, no further details need to be disclosed.

14. Accounting Standard 20 - Earnings Per Share (EPS)

Amount ₹

Particulars	31/03/2023	31/03/2022
Investment in Available for sale category	46,86,88,455	50,04,43,410
Investment Fluctuation Reserve at 5% of above	2,34,34,423	2,50,22,171
Investment Fluctuation Reserve held by Bank	90,00,000	70,00,000

12. The requirement of provision against Standard & Non-Performing Advances in terms of RBI guidelines are as follows:

15. In the opinion of the management, there is no impairment to assets in respect of which Accounting standard 28 on "Impairment to Assets" applies.

16. Appropriations of Profit

The Bank presents appropriation of current year profit in the current year's Profit & Loss Account. These appropriations will be effective once they are approved in the ensuing Annual General Meeting.

16. Appropriations of Profit

The Bank presents appropriation of current year profit in the current year's Profit & Loss Account. These appropriations will be effective once they are approved in the ensuing Annual General Meeting.

Sr. No.	Particulars	Amount ₹	Amount ₹
1	Gross Profit 2022-23		2,61,09,675
	Less:		
2	Provisions		97,15,416
	i) Provision To Staff Leave Encashment	10,08,036	
	ii) Provision For Income Tax	57,00,000	
	iii) Provision To Special Reserve For B&D (U/S 36(1) (Vii))	21,00,000	
	iv) Provision To Special Reserve For NPA (U/S 36(1) (Viii))	9,20,000	
	v) Provision To Deferred Tax	(12,620)	
3	Net Profit (Profit After Provision & Tax)		1,63,94,259
[A]	Appropriation As Per Bye-Laws 41 & 41(A)		1,23,51,094
	1) Reserve Fund (25% of Net profit)	40,98,565	
	2) BDDR (U/S 67(A) Gcs Act, 1961) (8% of Net profit)*	13,11,541	
	3) Dividend Declared (12.00%) (Subject To Approval In AGM)	39,10,463	
	4) Dividend Equalisation Fund 2% (Max 12% of Paid-up Shr)*	3,30,525	
	5) Education Fund (U/S 69 Gcs Act, 1961)		
	(2% Np or 2.00 Lakh Low)	2,00,000	
	6) Investment Fluctuation Reserve (IFR)*	25,00,000	
[B]	Appropriation As Per Bye-Laws 41(B) (Balance of Net Profit)		40,43,165
	1) Social Welfare Fund 20.00%	8,08,633	
	2) Members Welfare Fund 20.00%	8,08,633	
	3) For Religious Purpose 10.00%	4,04,317	
	4) Co-Operation Publicity 5.00%	2,02,158	
	5) Building Fund 30.00% (Remaining of Net Profit)	18,19,424	

17. The Bank is in the process of obtaining information from suppliers/service providers covered under Micro, Small, Medium Enterprises Development Act, 2006, regarding filing of necessary memorandum with the appropriate authority. Therefore, information relating to cases of delays, if any, in payments to such enterprises or of interest payments due to delays in such payments, could not be given.

18. Figures for the previous year are regrouped to make them comparable with the figures for the current year.

19. Disclosures as required by RBI Circular DOR.ACC.REC. No.45/21.04.018 / 2021-22 dated August 30, 2021.

1. Regulatory Capital
a) Composition of Regulatory Capital

(Amount in ₹ crore)

Sr. No.	Particulars	31/03/2023	31/03/2022
i)	Common Equity Tier 1 capital (CET 1)* / Paid up share capital and reserves@ (net of deductions, if any)	13.88 12.96	
ii)	Additional Tier 1 capital*/ Other Tier 1 capital@ 0.00 0.00		
iii)	Tier 1 capital (i + ii) 13.88 12.96		
iv)	Tier 2 capital 0.58 1.44		
v)	Total capital (Tier 1+Tier 2) 14.46 14.40		
vi)	Total Risk Weighted Assets (RWAs) 46.68 43.11		
vii)	CET 1 Ratio (CET 1 as a percentage of RWAs)* /Paid-up share capital and reserves as percentage of RWAs@	29.73%	30.06%
viii)	Tier 1 Ratio (Tier 1 capital as a percentage of RWAs)	29.73%	30.06%
ix)	Tier 2 Ratio (Tier 2 capital as a percentage of RWAs)	1.24%	3.34%
x)	Capital to Risk Weighted Assets Ratio (CRAR) (Total Capital as a percentage of RWAs)	30.98%	34.67%
xi)	Leverage Ratio*	-	-
xii)	Percentage of the shareholding of a) Government of India b) State Government (specify name) \$ c) Sponsor Bank \$	-	-
xiii)	Amount of paid-up equity capital raised during the year 0.28 0.21		
xiv)	Amount of non-equity Tier 1 capital raised during the year, of which: Give list 7 as per instrument type (perpetual non-cumulative preference shares, perpetual debt instruments, etc.). Commercial banks (excluding RRBs) shall also specify if the instruments are Basel II or Basel III compliant.	-	-
xv)	Amount of Tier 2 capital raised during the year, of which: Give list 8 as per instrument type (perpetual non-cumulative preference shares, perpetual debt instruments, etc.). Commercial banks (excluding RRBs) shall also specify if the instruments are Basel II or Basel III compliant.		

b) Draw down from Reserves

Not Applicable

2. Asset liability management
a) Maturity pattern of certain items of assets and liabilities

(Amount in ₹ crore)

	Day 1	2 to 7 days	8 to 14 days	15 to 30 Days	31 Days to 2 Months	Over 2 Month and to 3 Months	Over 3 Month and up to 6 Months	Over 6 Month and up to 1 Year	Over 1 Year and up to 3 Years	Over 3 Year and up to 5 Years	Over 5 Years	Total
Deposits	0.29	0.88	6.88	1.69	3.83	4.26	12.33	23.18	54.03	0.35	0.01	107.72
Advances	1.97	0.07	0.20	0.55	1.07	2.41	5.48	9.82	2.80	4.81	24.6	53.77
Investments	0.22	4.47	2.49	0.00	2.96	7.25	7.86	11.2	17.71	15.94	8.74	78.84
Borrowings												NIL
Foreign Currency assets												NIL
Foreign Currency assets liabilities												NIL



3. Investments

a) Composition of Investment Portfolio

As at 31/03/2023

(Amount in ₹ crore)

	Investments in India							Investments outside India				
	Government Securities	Other Approved Securities	Shares	Debentures and Bonds	Subsidiaries and / or joint ventures	Others	Total investments in India	Government securities (including local authorities)	Subsidiaries and / or joint ventures	Others	Total Investments outside India	Total Investments
Held to Maturity												
Gross	15.37	0.00					15.37					15.37
Less: Provision for NPI												
Net	15.37	0.00					15.37					15.37
Available for Sale												
Gross	15.86	31.01					46.87					46.87
Less: Provision for depr and NPI												
Net	15.86	31.01					46.87					46.87
Held for Trading	0.00	0.00					0.00					0.00
Gross												
Less: Provision for depr and NPI												
Net	0.00	0.00					0.00					0.00
Total Investments	31.23	31.01					62.24					62.24
Less: Provision for depr and NPI												
Nett Investments	31.23	31.01					62.24					62.24

As at 31/03/2022 (Amount in ₹ crore)

	Investments in India							Investments outside India				Total Investments
	Government Securities	Other Approved Securities	Shares	Debentures and Bonds	Subsidiaries and / or joint ventures	Others	Total investments in India	Government securities (including local authorities)	Subsidiaries and / or joint ventures	Others	Total Investments outside India	
Held to Maturity												
Gross	15.37						15.37					15.37
Less: Provision for NPI												
Net	15.37						15.37					15.37
Available for Sale												
Gross	18.85	30.69				0.50	50.04					50.04
Less: Provision for depr and NPI												
Net	18.85	30.69				0.50	50.04					50.04
Held for Trading												
Gross	0.00						0.00					0.00
Less: Provision for depr and NPI												
Net	0.00						0.00					0.00
Total Investments	34.22	30.69				0.50	65.41					65.41
Less: Provision for depr and NPI												
Nett Investments	34.22	30.69				0.50	65.41					65.41

For the year ended March 31, 2023

b) Movement of Provisions for Depreciation and Investment Fluctuation Reserve

(Amount in ₹ crore)

Particulars	31/03/2023	31/03/2022
i) Movement of provisions held towards depreciation on investments		
a) Opening balance	0.54	0.54
b) Add: Provisions made during the year	0.00	0.00
c) Less: Write off / write back of excess provisions during the year	0.00	0.00
d) Closing balance	0.54	0.54
ii) Movement of Investment Fluctuation Reserve		
a) Opening balance	0.7	0.5
b) Add: Amount transferred during the year	0.2	0.2
c) Less: Drawdown	0.0	0.0
d) Closing balance	0.9	0.7
iii) Closing balance in IFR as a percentage of closing balance of investments in AFS and HFT/Current category	1.92	1.40

c) Sale and transfers to/from HTM category - NA
d) Non-SLR investment portfolio

- i) Non-performing non-SLR investments - NA
- ii) Issuer composition of non-SLR investments

(Amount in ₹ crore)

Sr. No.	Issuer	Amount		Extent of Private Placement		Extent of 'Below Investment Grade' Securities		Extent of 'Unrated' Securities		Extent of 'Unlisted' Securities	
(1)	(2)	(3)		(4)		(5)		(6)		(7)	
		31/03/2023	31/03/2022	31/03/2023	31/03/2022	31/03/2023	31/03/2022	31/03/2023	31/03/2022	31/03/2023	31/03/2022
a)	PSUs										
b)	FIs										
c)	Banks		0.00								
d)	Private Corporates										
e)	Subsidiaries/ Joint Ventures										
f)	Others		0.50								
g)	Provision held towards depreciation		0.00								
	Total *		0.50								

e) Repo transactions - NA

For the year ended March 31, 2023

3. Asset quality

a) Classification of advances and provisions held¹⁵

	Standard	Sub-standard	Non-Performing		Total Non-Performing Advances	Total
	Total Standard Advances		Doubtful	Loss		
Gross Standard Advances and NPAs						
Opening Balance	49.96	1.48	1.11	1.22	3.81	53.77
Add: Additions during the year						
Less: Reductions during the year*						
Closing balance	49.96	1.48	1.11	1.22	3.81	53.77
*Reductions in Gross NPAs due to:						
i) Upgradation						
ii) Recoveries (excluding recoveries from upgraded accounts)						
iii) Technical/ Prudential ¹⁶ Write-offs						
iv) Write-offs other than those under (iii) above						
Provisions (excluding Floating Provisions)						
Opening balance of provisions held	0.16	1.30	3.46	5.96	10.55	10.71
Add: Fresh provisions made during the year					0.19	0.19
Less: Excess provision reversed/ Write-off loans					0.00	0.00
Closing balance of provisions held	0.16	1.30	3.46	5.96	10.74	10.90
Net NPAs¹⁷	0.00	0.00	0.00	0.00	0.00	0.00
Opening Balance						
Add: Fresh additions during the year						
Less: Reductions during the year						
Closing Balance		0.00	0.00	0.00	0.00	0.00

	Standard	Sub - standard	Non- Performing		Total Non-Performing Advances	Total
	Total Standard Advances		Doubtful	Loss		
Floating Provisions						
Opening Balance						
Add: Additional provisions made during the year						
Less: Amount drawn down ¹⁸ during the year						
Closing balance of floating provisions						
Technical write-offs and the recoveries made thereon						
Opening balance of Technical/ Prudential written - off accounts						
Add: Technical/ Prudential write-offs during the year						
Less: Recoveries made from previously technical / prudential written-off accounts during the year						
Closing balance						

Ratios (in percent)	31/03/2023	31/03/2022
Gross NPA to Gross Advances	7.09	7.05
Net NPA to Net Advances	0.00	0.00
Provision coverage ratio	286.22	315.10


b) Sector-wise Advances and Gross NPAs

(Amounts in ₹ crore)

Sr. No.	Sector *	31/03/2023			31/03/2022		
		Outstanding Total Advances	Gross NPAs	Percentage of Gross NPAs to Total Advances in that sector	Outstanding Total Advances	Gross NPAs	Percentage of Gross NPAs to Total Advances in that sector
i)	Priority Sector						
a)	Agriculture and allied activities						
b)	Advances to industries sector eligible as priority sector lending	30.77	2.74	8.91	29.14	2.54	8.72
c)	Services	10.29	0.43	4.18	8.00	0.38	4.75
d)	Personal loans	0.10	0.00	0.00	0.02	0.00	0.00
	Subtotal (i)	41.16	3.17	7.70	37.16	2.92	7.86
ii)	Non-priority Sector						
a)	Agriculture and allied activities						
b)	Industry	7.56	0.50	6.61	6.93	0.37	5.34
c)	Services	4.86	0.14	2.88	4.11	0.11	2.68
d)	Personal loans	0.19	0.00	0.00	0.00	0.00	0.00
	Sub-total (ii)	12.61	0.64	5.08	11.04	0.48	4.35
	Total (I + ii)	53.77	3.81	7.09	48.20	3.40	7.05

c) Overseas assets, NPAs and revenue - NA
d) Particulars of resolution plan and restructuring - NA
e) Divergence in asset classification and provisioning - NA
f) Disclosure of transfer of loan exposures - NA
g) Fraud accounts – NIL
h) Disclosure under Resolution Framework for COVID-19-related Stress – NIL
5. Exposures
a) Exposures to Real Estate Sector – NA
b) Exposure to Capital Markets – NA
c) Risk category-wise country exposure - NA
d) Unsecured advances

Banks shall disclose the total amount of advances for which intangible securities such as charge over the rights, licenses, authority, etc. have been taken as also the estimated value of such intangible collateral as per the following format.

(Amounts in ₹ crore)

Particulars	31/03/2023	31/03/2022
Total unsecured advances of the bank	0.02	0.02
Out of the above, amount of advances for which intangible securities such as charge over the rights, licenses, authority, etc. have been taken	0.00	0.00
Estimated value of such intangible securities	0.00	0.00

e) Factoring exposures - NA
f) Intra-group exposures - NA
g) Unhedged foreign currency exposure - NA

6. Concentration of deposits, advances, exposures and NPAs
a) Concentration of deposits

(Amount in ₹ crore)

Particulars	31/03/2023	31/03/2022
Total deposits of the twenty largest depositors	6.45	6.83
Percentage of deposits of twenty largest depositors to total deposits of the bank	5.99%	6.40%

b) Concentration of advances*

(Amount in ₹ crore)

Particulars	31/03/2023	31/03/2022
Total advances to the twenty largest borrowers	10.99	10.30
Percentage of advances to twenty largest borrowers to total advances of the bank	20.44%	21.37%

c) Concentration of exposures**

(Amount in ₹ crore)

Particulars	31/03/2023	31/03/2022
Total exposure to the twenty largest borrowers/customers	14.71	13.16
Percentage of exposures to the twenty largest borrowers/ customers to the total exposure of the bank on borrowers/customers	20.39%	20.43%

**Exposures shall be computed as per applicable RBI regulation.

d) Concentration of NPAs

(Amount in ₹ crore)

Particulars	31/03/2023	31/03/2022
Total Exposure to the top twenty NPA accounts	3.47	2.60
Percentage of exposures to the twenty largest NPA exposure to total Gross NPAs.	64.11%	50.68%

7. Derivatives

- a) Forward rate agreement/Interest rate swap – NA
- b) Exchange traded interest rate derivatives – NA
- c) Disclosures on risk exposure in derivatives – NA
- d) Credit default swaps - NA

The Bank does not deal in derivative instruments and so these disclosures are not applicable

8. Disclosures relating to securitization – Not Applicable to UCBs.
9. Off balance sheet SPVs sponsored (which are required to be consolidated as per accounting norms) – Not Applicable to UCBs.
10. Transfers to Depositor Education and Awareness Fund (DEA Fund)

(Amount in ₹ crore)

Sr. No.	Particulars	31/03/2023	31/03/2022
i)	Opening balance of amounts transferred to DEA Fund	1.58	0.92
ii)	Add: Amounts transferred to DEA Fund during the	0.09	0.68
iii)	Less: Amounts reimbursed by DEA Fund towards claims	0.02	0.02
iv)	Closing balance of amounts transferred to DEA Fund	1.65	1.58

11. Disclosure of complaints
a) Summary information on complaints received by the bank from customers and from the Offices of Ombudsman³²

Sr. No.	Particulars	31/03/2023	31/03/2022
	Complaints received by the bank from its customers		
1.	Number of complaints pending at beginning of the year		
2.	Number of complaints received during the year		1
3.	Number of complaints disposed during the year		1
3.1	Of which, number of complaints rejected by the bank		
4.	Number of complaints pending at the end of the year		
	Maintainable complaints received by the bank from Office of Ombudsman		
5.	Number of maintainable complaints received by the bank from Office of Ombudsman		
5.1	Of 5, number of complaints resolved in favour of the bank by Office of Ombudsman		
5.2	Of 5, number of complaints resolved through conciliation/mediation/advisories issued by Office of Ombudsman		1
5.3	Of 5, number of complaints resolved after passing of Awards by Office of Ombudsman against the bank		
6.	Number of Awards unimplemented within the stipulated time (other than those appealed)		

Note: Maintainable complaints refer to complaints on the grounds specifically mentioned in Integrated Ombudsman Scheme, 2021 (Previously Banking Ombudsman Scheme, 2006) and covered within the ambit of the Scheme.

b) Top five grounds³³ of complaints received by the bank from customers – NIL
12. Disclosure of penalties imposed by the Reserve Bank of India – NA
13. Disclosures on remuneration – Not Applicable to UCBs.
14. Other Disclosures
a) Business ratios

	Particulars	31/03/2023	31/03/2022
i)	Interest Income as a percentage to Working Funds	6.99%	6.73%
ii)	Non-interest income as a percentage to Working Funds	0.38%	0.39%
iii)	Cost of Deposits	3.99%	4.00%
iv)	Net Interest Margin	3.93%	3.77%
v)	Operating Profit as a percentage to Working Funds	1.83%	1.46%
vi)	Return on Assets	1.81%	0.91%
vii)	Business (deposits plus advances) per employee (in ₹ crore)	3.93	3.60
viii)	Profit per employee (in ₹ crore)	0.06	0.03

b) Bancassurance business – NA
c) Marketing and distribution - NA

Banks shall disclose the details of fees / remuneration received in respect of the marketing and distribution function (excluding bancassurance business) undertaken by them.

d) Disclosures regarding Priority Sector Lending Certificates (PSLCs) – NA

e) Provisions and contingencies

(Amount in ₹ crore)

Provision debited to Profit and Loss Account	31/03/2023	31/03/2022
i) Provisions for NPI	0.20	0.20
ii) Provision towards NPA	0.30	0.26
iii) Provision made towards Income tax	0.57	0.47
iv) Other Provisions and Contingencies (with details)	0.10	0.07

f) Implementation of IFRS converged Indian Accounting Standards (Ind AS)

– Not Applicable to UCBs,

g) Payment of DICGC Insurance Premium

(Amount in ₹ crore)

Sr. No.	Particulars	31/03/2023	31/03/2022
i)	Payment of DICGC Insurance Premium	0.15	0.15
ii)	Arrears in payment of DICGC premium	0.00	0.00

h) Disclosure of facilities granted to directors and their relatives

Sr. No.	Particulars	Limits ₹ lacs	Remarks	RBI Guideline
1	Amber Stationers (Relative of Director)	1.20	Current Overdraft against FD	Exempt
2	Ekta Trading Co. (Relative of Director)	25.40	Current Overdraft against FD	Exempt

i) Disclosure on amortization of expenditure on account of enhancement in family pension of employees of banks – NA

For S. F. Tai & Associates
Chartered Accountants
FRN: 114819W

(Shariq Tai)
Partner
M. No.: 162784

KNOW YOUR BANK

Bank Name	:	Alavi Co-operative Bank Ltd.
Bank Code	:	322
RBI License No.	:	UBD/GJ/773/P (Dt. 18.12.1986)
Registered Office	:	Wadi Chokhandi, Vadodara - 17
Branch	:	3 (Three)
Regi. No.	:	15659 (Dt. 01.10.1958)
PAN	:	AAAAA0966A
GST No.	:	24AAAAA0966A2ZG
Chairman	:	Mr. Shabbirhussain M. Motorwala
M.D.	:	Mr. Zakirhussain F. Marchawala
Joint M.D.	:	Mr. Talib S. Dawawala
IFSC Code	:	HDFC0CALAVI
Email	:	info@alavibank.com
Website	:	www.alavibank.com


Cash Flow Statement for the Year ended 31/03/2023
Direct Method

PARTICULARS	Mar-2022	Mar-2023
A. CASH FLOW FROM OPERATING ACTIVITIES		
Increase/(Decrease) in Net Profit	2,426,945.46	(709,641.72)
Increase/(Decrease) in Deposits	93,416,113.14	77,269,297.21
(Increase)/Decrease in Advances	(37,059,300.19)	(19,773,939.26)
(Increase)/Decrease in Investment	13,193,093.00	(102,835,687.22)
Increase/(Decrease) in Branch Adjustment	-	500.00
Increase/(Decrease) in Reserves & Surplus	12,326,349.30	12,850,089.56
(Increase)/Decrease in Interest Receivable	504,898.00	(605,805.72)
Increase/(Decrease) in Interest Payable	(987,129.00)	(1,111,034.00)
(Increase)/Decrease in Other Assets	18,182,199.27	(5,140,390.78)
Increase/(Decrease) in Other Liabilities	(19,644,405.58)	3,589,668.52
Net Cash Flow from Operating Activities (A)	82,358,763.40	(36,466,943.41)
B. CASH FLOW FROM INVESTING ACTIVITIES		
(Increase)/Decrease in Land & Building	530,432.00	477,388.00
(Increase)/Decrease in Fixed Assets	(342,414.60)	(193,227.08)
Cash Flow from Investing Activities (B)	188,017.40	284,160.92
C. CASH FLOW FROM FINANCING ACTIVITIES		
Increase/(Decrease) in Share Capital	318,170.00	2,062,050.00
Increase/(Decrease) in Borrowings	-	-
Cash Flow from Financing Activities (C)	318,170.00	2,062,050.00
NET INCREASE IN CASH & EQUIVALENTS (A + B + C)	82,864,950.80	(34,120,732.49)
Opening Balance of Cash & Cash Equivelant	177,704,991.79	260,569,942.59
Closing Balance of Cash & Cash Equivelant	260,569,942.59	226,449,210.10
NET INCREASE / (DECREASE) in CASH & CASH EQUIVALENTS	82,864,950.80	(34,120,732.49)

For Alavi Co-operative Bank Ltd.
Officer / Account

____ 32 ____

તારીખ ૩૧.૦૩.૨૦૨૩ આખર હેડ ઓફીસ અને શાખાઓની માહિતી

	હેડ ઓફીસ	આજવારોડ શાખા	ફ્લોગિંગ શાખા	કુલ સરવાળો
ડીપોઝીટ	રૂા. ૫૮,૮૦,૭૬,૩૮૪.૨૮	રૂા. ૩૮,૦૩,૨૮,૬૪૬.૪૦	રૂા. ૮,૭૭,૮૭,૬૨૭.૩૬	રૂા. ૧,૦૭,૭૧,૮૨,૬૫૮.૦૪
ધિરાણો	રૂા. ૨૮,૮૬,૪૫,૨૦૪.૫૮	રૂા. ૨૦,૪૬,૮૧,૭૮૨.૭૪	રૂા. ૪,૪૩,૮૬,૭૪૮.૬૦	રૂા. ૫૩,૭૭,૧૩,૭૪૫.૮૨
ગ્રોસ નફો	રૂા. ૧,૫૪,૮૭,૫૧૨.૬૭	રૂા. ૮૮,૪૭,૮૮૨.૨૫	રૂા. ૭,૭૪,૧૮૦.૨૬	રૂા. ૨,૬૧,૦૮,૬૭૫.૧૮
વિગત	૩૧.૦૩.૨૦૨૨	૩૧.૦૩.૨૦૨૩	વધારો/ઘટાડો	ટકાવારી
શેર ભંડોળ	૩,૧૭,૦૮,૮૪૦.૦૦	૩,૪૪,૬૩,૨૨૦.૦૦	+૨૭,૫૪,૩૮૦.૦૦	+૮.૬૮%
થાપણો	૧,૦૬,૭૫,૫૮,૭૦૪.૫૨	૧,૦૭,૭૧,૮૨,૬૫૮.૦૪	+૮૬,૩૩,૮૬૩.૫૨	+૦.૮૦%
ધિરાણો	૪૮,૧૮,૮૬,૭૮૮.૮૫	૫૩,૭૭,૧૩,૭૪૫.૮૨	+૫,૫૭,૨૬,૮૫૬.૯૭	+૪.૨૮%
રીઝર્વ તથા અન્ય ફંડો	૨૫,૫૮,૧૨,૫૪૭.૬૨	૨૬,૭૪,૮૨,૨૨૭.૨૬	+૧,૧૫,૬૮,૬૭૯.૬૪	+૪.૫૨%
કાર્યકારી ભંડોળ	૧,૪૧,૩૮,૩૮,૮૮૭.૦૨	૧,૪૨,૫૫,૭૮,૮૮૫.૨૮	+૧,૧૭,૪૦,૦૮૮.૨૬	+૭.૧૨%
કુલ ગ્રોસ નફો	૨,૦૬,૫૭,૭૭૭.૬૪	૨,૬૧,૦૮,૬૭૫.૧૮	+૫૪,૫૧,૮૮૭.૫૪	+૨૬.૩૮%
ચોખ્ખો નફો	૧,૨૬,૭૧,૦૬૧.૬૪	૧,૬૩,૮૪,૨૫૮.૧૮	+૩૭,૨૩,૧૯૭.૫૪	+૨૮.૩૮%
સભાસદ સંખ્યા	૧૧,૪૪૫	૧૧,૪૮૦	+૩૫	+૦.૩૧%
ઓડીટ વર્ગ	‘અ’	‘અ’		

૨૦૨૩-૨૪ ના વર્ષનું અંદાજિત ખર્ચનું બજેટ

સને ૨૦૨૨-૨૩ ના વર્ષ દરમિયાન નીચે પ્રમાણેના ખર્ચનું બજેટ વ્યવસ્થાપક મંડળને વર્ગ ફેર કરવાના અધિકાર સહ મંજૂર કરવા ભલામણ છે.

વિગત	૨૦૨૨-૨૩ ના વર્ષ માટે અંદાજિત રકમ	૨૦૨૨-૨૩ ના વર્ષ દરમિયાન થયેલ ખર્ચની રકમ	૨૦૨૩-૨૪ ના વર્ષ માટે અંદાજિત રકમ
૧. પગાર, ભથ્થા, ભાડા, પ્રો.ફંડ, ગ્રેજ્યુઇટી	૨,૮૫,૨૦,૦૦૦	૨,૪૪,૮૪,૭૨૬	૨,૮૫,૦૦,૦૦૦
૨. ડીરેક્ટર્સ ફી તથા ભથ્થા	૫,૫૦,૦૦૦	૪,૮૮,૮૧૫	૬,૫૦,૦૦૦
૩. ભાડું, કર, વિમો, વિજળી વિગેરે	૨૪,૦૦,૦૦૦	૨૮,૧૩,૩૬૫	૩૦,૦૦,૦૦૦
૪. કોર્ટ તથા વકીલ ફી / કાનુની ખર્ચ	૨,૩૦,૦૦૦	૫,૬૮,૬૦૦	૪,૫૦,૦૦૦
૫. તાર, ટપાલ અને ટેલીફોન	૧,૨૫,૦૦૦	૮૮,૬૧૩	૧,૨૫,૦૦૦
૬. ઓડીટ ફી	૨,૭૬,૦૦૦	૨,૩૮,૦૦૦	૨,૭૬,૦૦૦
૭. મિલ્કત મરામત અને ઘસારા ખર્ચ તથા મિલ્કત વેચાણ થી થયેલ ખોટ	૨૧,૭૫,૦૦૦	૨૨,૩૮,૨૦૬	૨૪,૦૦,૦૦૦
૮. સ્ટેશનરી, છાપકામ અને જાહેરાત ખર્ચ	૩,૫૦,૦૦૦	૧,૮૦,૮૧૪	૩,૦૦,૦૦૦
૯. પરચુરણ તથા અન્ય ખર્ચ	૬૦,૦૦,૦૦૦	૪૮,૨૬,૭૩૮	૫૫,૦૦,૦૦૦
૧૦. સ્ટાફ લીવ એન્કેશમેન્ટ જોગવાઈ	૭,૦૦,૦૦૦	૧૦,૩૮,૦૩૬	૧૦,૦૦,૦૦૦
કુલ સરવાળો	૪,૧૩,૨૬,૦૦૦	૩,૮૦,૫૭,૮૮૧	૪,૨૨,૦૧,૦૦૦

BOD Resolution No. Dt. 31 / 08 / 2023


FIXED DEPOSIT RATES
With Effect from 01-July--2023 (BOD R.No.11 Dt.23/06/2023)

PERIOD				Individual	Senior Citizen	Staff Member
From	46 DAYS	To	90 DAYS	5.00%	5.25%	6.00%
From	91 DAYS	To	180 DAYS	5.50%	5.75%	6.50%
From	181 DAYS	To	Below 1 Yr (364 Days)	6.00%	6.25%	7.00%
From	1 YEAR	To	5 Years	6.50%	7.25%	7.50%
After	1 YEAR	1000	Become	1067	1075	1077
After	2 YEARS	1000	Become	1138	1155	1160
After	3 YEARS	1000	Become	1213	1241	1250
After	4 YEARS	1000	Become	1294	1333	1346
After	5 YEARS	1000	Become	1380	1432	1450

**** Now deposits above 60 months (5 Years) are not to be accepted. ****
Penalty for Premature Withdrawal of FDR (w.e.f. 01/01/2018) (BOD R.No. 8(6) Dt. 12/12/17)

Nil Penalty Deposit less than ₹1 Lakh withdrawn on or after completion of 12 months

Penalty @ 0.50% Deposit less than ₹ 1.00 Lakh withdrawn before completion of 12 months

Penalty @ 1.00% Deposit of ₹ 1.00 Lakh & Above withdrawn prematurely.

Interest will be paid @ 3.00% on Term Deposits which remains for a period of greater than 7 days but less than 46 days. No interest will be paid on Deposit which remains for a period of less than 7 days

From Now on, Senior Citizen will be paid additional 0.50% interest on term deposit of 1 year to 5 years (self attested copy of anyone of Birth Certificate / Pan Card / Adhar Card / Driving Licence / Passport / Election Card / I Card issued by Government as

From Now on, No Additional Interest will be paid in the Saving Account of the Senior Citizens & Staff / Exstaff members.

All deposit accounts must be complied with KYC documents as per RBI guidelines.

SAVING BANK ACCOUNT 3.00% (On Daily Product Basis) (BOD 16/07/2021 Reso.20(iv))
RECURRING DEPOSIT CHART
With Effect from 01-Sept-2022

	Amount	12 MTHS	24 MTHS	36 MTHS	48 MTHS	60 MTHS
Individual	100	1238	2548	3936	5405	6960
Sr. Citizen	100	1241	2562	3967	5462	7052
Staff	100	1244	2575	3998	5519	7146

For ALAVI CO-OPERATIVE BANK LTD

LOAN RATES

Sr. No.	Loan Type	Limit	Rate of Interest
1	Cash Credit Hypothecation	Upto Rs. 10 Lakhs	10.75%
	Cash Credit Hypothecation	Above Rs. 10 Lakhs	10.25%
2	Overdraft against Property	Upto Rs. 10 Lakhs	11.25%
	Overdraft against Property	Above Rs. 10 Lakhs	10.75%
3	Overdraft against Property	Upto Rs. 10 Lakhs	12.25%
	Overdraft against Property	Above Rs. 10 Lakhs	11.75%
4	Working Capital Term Loan	Any Limit	11.25%
5	Term Loan	Any Limit	12.00%
6	Car Loan / Vehicle Loan	Any Limit	9.00%
7	Scooter / Motorcycle Loan / HLG	Any Limit	9.00%
8	Home Loan	Upto Rs. 50 Lakhs (As per the Loan Policy clause no. 5(8) last reviewed on 18.11.2022)	9.75%
9	Solar System Installation Loan	Upto Rs. 5 Lakhs	10.75%
10	Education Loan	Upto Rs. 25 Lakhs	8.75%
11	Gold Loan Bullet Payment	Upto Rs. 2 Lakhs	9.25%
12	Gold Term Loan	Upto Rs. 35 Lakhs	10.25%
13	Machinery Loan	Upto Rs. 25 Lakhs	11.25%
	Machinery Loan	Any Limit	10.25%
14	NSC/KVP/LIC/Postal Savings Certificate/ANY other GOVT. SEC Loan	Any Limit	10.50%

સભાસદો, ખાતાદારો અને ગ્રાહકો જોગ અગત્યની સુચના

સભાસદો માટે :

- જે સભાસદો શેર સર્ટીફિકેટ લેવાના બાકી હોય તેઓએ બેન્કમાંથી મેળવી લેવા સુચન છે.
- ઈન્કમેટેક્સ એક્ટ ૧૯૬૧ ના સેક્સન ૧૯૪/એ હેઠળ મુદતી થાપણોના તમામ ખાતાઓનું સંયુક્ત વ્યાજ વાર્ષિક રૂ. ૪૦,૦૦૦/- (ચરિષ્ઠ નાગરિક માટે રૂ. ૫૦,૦૦૦/-) કે તેથી વધુ વ્યાજની આવક કરપાત્ર થતી ન હોય તેવા ખાતેદારો નાણાંકીય વર્ષની શરૂઆતમાં ફોર્મ 15G અથવા 15H બેંકમાં જમા કરાવી મળેલ વ્યાજ ની આવકમાંથી TDS કપાતમાંથી મુક્તિ મેળવી શકશે.
- સહકારી કાયદા અન્વયે વારસ નિમણુક ફરજિયાત છે. જે સભાસદોએ વારસની નિમણુક કરાવેલ નથી તેઓ એ સત્વરે નિમણુક કરાવી લેવી જેથી હયાતી બાદ વારસદારોને સુગમતા રહે.
- બેંકના જે સભાસદો કે ખાતેદારોનું અવસાન થયેલ હોય તેઓના વારસદારોએ તેઓનું મરણ સર્ટીફિકેટ રજુ કરી બેંકમાં જાણ કરવા અને તેની જરૂરી કાર્યવાહી કરાવી જવા વિનંતી.
- બેંક તરફથી આપવામાં આવેલ ઓળખપત્ર (૧) કરજ મેળવવા માટે (૨) જામીન તરીકે સહી કરવા આવો ત્યારે (૩) ડીવીડન્ડના નાણાં રોકડા મેળવતી વખતે (૪) વ્યવસ્થાપક મંડળની ચુંટણીના મતદાન સમયે (૫) બેંકની વાર્ષિક સાધારણ સભામાં અગર ખાસ સાધારણ સભાઓમાં હાજરી આપવાના સમયે તેમજ (૬) બેંક સાથેના કોઈપણ અન્ય વ્યવહાર સમયે સભાસદે અવશ્ય સાથે લાવવા વિનંતી છે.
- સભાસદોને બેંક તરફથી નવા સ્માર્ટકાર્ડ બનાવી આપવામાં આવે છે, જેથી જુના તમામ સભાસદોને જો તેઓએ નવા સ્માર્ટકાર્ડ બનાવેલ ન હોય તેઓએ જરૂરી ફી ભરી અને બે કલર ફોટા રજુ કરી નવા સ્માર્ટકાર્ડ બનાવી લેવા વિનંતી છે.
- ગ્રાહકની જેમ સભાસદોએ પોતાના KYC બેંકને રજુ કરવા ફરજિયાત છે. સક્ષમ KYC રજુ ન કરનારનું ડીવીડન્ડ અટકાવી શકાય છે.
- ડીવીડન્ડ એ સભાસદોનો હકક નથી તે નફાકારકતા આધારીત લાભ છે. ડીવીડન્ડની રકમ સભાસદોના સેવિંગ્સ/કરંટ ખાતે જમા કરાવવા માટેની સ્થાયી સુચના બેંકની નજીકની શાખામાં રજુ કરવા વિનંતી છે.
 - બેંક સાથેના પત્ર વ્યવહારની અનુકુળતા માટે જે સભાસદો, કરજદારો અને ખાતેદારોના સરનામામાં ફેરફાર થયેલ / અગર થવાનો હોય તેમને બેન્કને તુરંત જ લેખિત જાણ કરવાની રહેશે.
 - બેન્કમાં ઇલેક્ટ્રોનિકી બીલ, ગેસ બીલ, વેરા બીલની ચુકવણી માટેની સુવિધા શરૂ કરવામાં આવેલ જેનો વધુમાં વધુ લાભ લઈ બેન્કની પ્રગતિમાં સહભાગી બનશો એમ વિનંતી છે.

કરજદાર સભાસદો માટે :

- ધિરાણ મેળવવા માટે બેંકના ફોર્મમાં વિગતો સાચી અને પુરેપુરી લખવી જરૂરી છે. ઘંઘાનું સરવૈયું (ઓડીટર દ્વારા સર્ટીફાઈડ હોય તો તે), આવક અંગેના ઈન્કમેટેક્સ, જીએસટી અંગેના દાખલા (આધાર પુરાવા) મિલ્કતનો દાખલો, ભાગીદારી લેખ વિગેરે પુરા પાડવા જરૂરી છે. આપની અરજ અંગેની તપાસ માટે અધિકારી આવે ત્યારે તેને વિગતો અંગેના આધાર પુરાવા જરૂરી હોય તો તે બતાવશો જેથી અરજના નિકાલમાં સુગમતા રહે. અધુરી વિગતોવાળી અરજ ઉપર ધ્યાન આપી શકાશે નહીં.
- ધિરાણ ખાતાઓ પર માસિક ધોરણે વ્યાજની ગણતરી કરવામાં આવે છે. વ્યાજ તેમજ મુદ્દલ સમયસર વસુલ ન આવે તો તેવા કરજદારની ભવિષ્યની શાખને ગંભીર અસર પહોંચે છે. કેશ-કેડિટ ખાતાઓમાં સંતોષકારક લેવડ-દેવડ નહીં કરનાર કરજદારની શાખને અસર થાય છે.
- ધિરાણ મેળવ્યા બાદ હપ્તાઓ ભરવાની, સ્ટોક સ્ટેટમેન્ટ તા. ૧ થી ૫ સુધીમાં મોકલવાની, માલમિલ્કતનો વિમો સમયસર ઉતારવાની તથા દર મુદતે રીન્યુ કરાવવાની જવાબદારી ધિરાણ લેનારની છે. આ બાબતમાં અનિયમિતતા હશે તો સદર ખાતાની લેવડદેવડ અટકાવી ધિરાણ પરત વસુલ લેવા બેંકે કાર્યવાહી કરવી પડશે જેની દરેકે નોંધ લેવી.
- તમામ પ્રકારના કેશકેડિટ ખાતાઓ ની લિમિટ ની મુદત એક વર્ષની હોય છે જેથી મુદત પુરી થાય તે પહેલા રીન્યુઅલ રજુ કરવી જરૂરી છે. કરજ લેતા સભાસદોને તેમની સવલત ખાતર તેમણે લીધેલ કરજની મુદત, હપ્તા તથા વ્યાજની ખબર આપવામાં આવે છે. પરંતુ આ પ્રકારની ખબર આપવી બેંક માટે ફરજિયાત નથી અને આવી ખબર કરજદાર અગર જામીનદારને મળી ન હોય તો તે માટે બેંક જવાબદાર નથી.

જામીનદારો માટે :

- ધિરાણ લેનાર વ્યક્તિ સામાન્ય રીતે આપની સહુથી નજીક હોઈ તેની આર્થિક પરિસ્થિતિમાં બેંકનું ધિરાણ જોખમાય તેવા સંજોગો ઉપસ્થિત થયાનું જાણવામાં આવે કે તુરંત બેંકના અધિકારીનું લેખિતમાં ધ્યાન દોરશો. જામીનદાર પણ કરજદાર સભાસદ જેટલા જ રકમ ભરપાઈ કરવા માટે જવાબદાર છે. નહીં કે તેને ફાળે પડતા હિસ્સાની રકમ ભરપાઈ કરવા માટે. બેંક મુજબ કરજદારને છોડીને જામીન પાસે સીધી વસુલાત કરવા હકકદાર છે.
- જામીન તરીકે આપે બેંકનું ધ્યાન દોર્યાથી આપની જવાબદારી સમાપ્ત થતી નથી પરંતુ કરજદારના આપ જામીન છો તેનું પુરેપુરું ધિરાણ વ્યાજસહ સંપૂર્ણ ભરપાઈ ન થાય ત્યાં સુધી આપની જામીન તરીકે જવાબદારી ચાલુ જ રહે છે જેની નોંધ લેશો. ધિરાણ લેનાર વ્યક્તિ પાસે બેંકનું મુદત વિતેલ બાકી લેણું હશે અને તેમાં જામીન તરીકે હશે તો તમોને લોન મળી શકશે નહીં, જેનો ખ્યાલ રાખવા અને ધિરાણ લેનારની લોન નિયમિત થયા બાદ કે ચુકતે થયા બાદ જ તમોને લોન મળી શકશે જેની નોંધ લેશો.

ખાતેદારો માટે :

૧. બેંકમાં મુકાયેલ રૂ. ૫.૦૦ લાખ સુધીની વ્યક્તિગત થાપણો ડીપોઝીટ ઈન્સયોરન્સના વિમા કવચ હેઠળ સુરક્ષિત છે. જો બે સંયુક્ત નામની અલગ અલગ ડીપોઝીટ મુકવામાં આવશે તો એ પણ વિમા કવચ હેઠળ આવરી લેવામાં આવશે.
૨. ભારત સરકારના નોટીફિકેશન તેમજ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પરિપત્ર મુજબ દરેક બેંકોએ પોતાના ગ્રાહકોની CKYCR (સેન્ટ્રલ KYC રજીસ્ટ્રી) પ્રક્રિયા ફરજિયાત પણે પૂર્ણ કરવાની સુચના છે. જેથી બેંકના તમામ ખાતેદારોને જણાવવાનું કે અગાઉ KYC પૂર્ણ કરી હોય તો પણ CKYCR માટે નવેસરથી તાજેતરનો ફોટો, આધારકાર્ડ, પાનકાર્ડ, સરનામાનો પુરાવો, ધંધાનો પ્રકાર, આવક તેમજ વાર્ષિક ટર્નઓવરની વિગતો વિગેરે અપડેટ કરવાની હોવાથી લાગુ પડતા ડોક્યુમેન્ટ્સ નિર્ધારિત કસ્ટમર આઈડેન્ટીફિકેશન ફોર્મ સાથે વહેલી તકે જે શાખામાં આપનું ખાતું હોય ત્યાં તાત્કાલીક ધોરણે રજુ કરવાના રહેશે. ઉપરાંત જે ખાતેદારોએ છેલ્લા ૨ વર્ષ કે તેથી વધુ સમયથી પોતાના ખાતામાં વ્યવહારો કર્યા ન હોય તે કારણે ખાતું ડોરમેન્ટ (નિષ્ક્રિય) અવસ્થામાં હોય તેઓએ પણ આ સુચનાની ૧૫ દિવસની અંદર ઉપર જણાવ્યા પ્રમાણેના પુરાવાઓ રજુ કરી બેંકની શાખાની મુલાકાત લઈ ખાતું એક્ટિવેટ (સક્રીય) કરવા તેમજ CKYCR પૂર્ણ કરવા જણાવવામાં આવે છે.
૩. જે સગીર ખાતેદારો પુખ્ત વયના થયા છે તેઓએ આધારકાર્ડ અને અન્ય KYC મુજબના જરૂરી પુરાવાઓ સાથે રૂબરૂ બેંકમાં આવી પોતાના ખાતામાં Minor to Major ની પ્રોસેસ કરાવી લેવા જણાવવામાં આવે છે. અન્યથા આવા ખાતાઓ FREEZ કરી વહેવારો સ્થગિત કરી દેવામાં આવશે.
૪. બેંકના ગ્રાહકો માટે RTGS / NEFT / TDS-TCS / GST ની સુવિધા HDFC Bank ના સહયોગથી ચાલુ છે. LPG (GAS) સબસીડી, કંપનીઓના ડીવીડન્ડ, ગર્વમેન્ટ આર્થિક સહાય, ઈન્કમ ટેક્સ રીફંડ વિગેરેની જમા રકમ બેંકે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સંચાલિત આધાર પેમેન્ટ બ્રિજ સીસ્ટમ (APBS), નેશનલ ઇલેક્ટ્રોનિક ક્લીયરીંગ સીસ્ટમ, નેશનલ ઓટોમેટેડ ક્લીયરીંગ હાઉસ મારફતે ઈન્સ્ટીટ્યુટ ઓફ નંબર પ્રાપ્ત કરેલ હોય ગ્રાહકોના ખાતે જમા કરવામાં આવે છે. બેંકના ગ્રાહકો માટે POS Machine ની સુવિધા ઉપલબ્ધ છે જેના થકી કરંટ ખાતેદારોને રોકડ તથા ચેક ન હોય તો પણ આ મશીનથી ખાતેદાર પોતાની હેઠળી રકમ પ્રાપ્ત કરી શકે છે.
૫. બેંકના ગ્રાહકોના ખાતાના વ્યવહારો માટે SMS Alert, બેલેન્સની જાણકારી માટે Missed Call (Mob. 9275753000) ની સુવિધા કરવામાં આવેલ છે, જે માટે તમારા ખાતામાં મોબાઈલ રજીસ્ટ્રેશન કરવો જરૂરી હોય તમારી શાખાનો સંપર્ક કરવા વિનંતી.
૬. બેંકમાં ૧૦ વર્ષ કે તેથી વધુ સમય સુધી દાવા ન કરેલ ડીપોઝીટ (Unclaim) ખાતાની રકમ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના DEAF સ્કીમ-૨૦૧૪ ફંડમાં મોકલી આપવાની હોય છે. તેથી ડીપોઝીટ ખાતાઓમાં આ બાબતનો ખ્યાલ રાખશે.
૭. આપની થાપણોની મુદત પુરી થયે રીન્યુ કરવા માટે સંબંધિત રહેશે, અન્યથા આવી થાપણો અગાઉ જેટલા સમય માટે મુકી હશે તેટલા સમય માટે ઓટોમેટીક રીન્યુ થઈ જશે જેની નોંધ લેશે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના તા. ૨૫/૦૮/૨૦૨૦ ના સરકયુલર મુજબ તા. ૦૧/૦૧/૨૦૨૧ થી ચેકની વસુલાત માટે બમણી સુરક્ષા એટલે પોઝીટીવ પે સીસ્ટમ લાગુ કરવામાં આવેલ છે, તેથી તે મુજબ રૂ. ૫.૦૦ લાખ કે તેથી વધુના ક્લીયરીંગના ચેકો લખનાર ખાતેદારે અલવી કો-ઓપરેટીવ બેંક લિ. ને અગાઉથી ચેકના લાભકર્તાનું નામ, ચેકની રકમ, ચેક નંબર, ખાતાનો પ્રકાર, ખાતા નંબર (15 Digits) વિ.ની વિગતો જણાવવાની રહેશે. વધુમાં જણાવવાનું કે આપના ખાતામાં બેલેન્સ હોય તેવા સંગોમાં પણ અગાઉથી બેંકને કન્ફર્મેશન નહીં કરેલ હોય તો ક્લીયરીંગમાં આવેલ ચેક પાસ કરવા કે ન કરવા તે બેંકના હક્ક ને આધિન રહેશે.

પેટા કાયદો નં.	ચાલુ પેટા કાયદો	સુધારેલ પેટા કાયદો	સુધારા માટે ના કારણો
૮(૮)	મૃત્યુ પામેલ સભાસદ ને ચુકવવામાં આવતી મરણસહાય ની રકમ રૂ. ૧૫૦૦૦/- કરેલ જે તા. ૨૪/૦૮/૨૦૨૨ ના વ્યવસ્થાપક મંડળ ના ઠરાવ નં. ૧૨ મુજબ મૃત્યુ પામેલ સભાસદ ને ચુકવવામાં આવતી મરણસહાય ની રકમ રૂ. ૧૫,૦૦૦/- થી ઘટાડીને રૂ. ૧૦,૦૦૦/- કરવાનું સર્વાનુમતે બહાલ કરેલ છે.	મૃત્યુ પામેલ સભાસદ ને ચુકવવામાં આવતી મરણસહાય ની રકમ રૂ. ૧૦૦૦૦/- કરેલ જે તા. ૩૧/૦૮/૨૦૨૩ ના વ્યવસ્થાપક મંડળ ના ઠરાવ નં. ૧૭ એ મુજબ મૃત્યુ પામેલ સભાસદ ને ચુકવવામાં આવતી મરણસહાય ની રકમ રૂ. ૧૦,૦૦૦/- થી વધારીને રૂ. ૧૫,૦૦૦/- કરવાનું સર્વાનુમતે બહાલ કરેલ છે.	તા. ૩૧/૦૮/૨૦૨૩ ના વ્યવસ્થાપક મંડળ ના પ્રમુખસ્થાન ના ઠરાવ નં. ૧૭ એ મુજબ બહાલી બાબતે સુધારો
૨૮(૧)	જો કોઈપણ સભાસદે બેન્કનો એક શેર ધારણ કરેલો હશે તે ડીરેક્ટર બનવા માટે લાયકાત ધરાવે છે.	જો કોઈપણ સભાસદે બેન્કના કુલ ૧૦૦૦ શેર ધારણ કરેલ હશે તે ડીરેક્ટર બનવા માટે લાયકાત ધરાવે છે.	તા. ૨૮/૦૪/૨૦૨૩ ના વ્યવસ્થાપક મંડળના ઠરાવ નં. ૩૦(સી) મુજબ બહાલી બાબતે સુધારો.
૨૮(૫) ૧(અ)	કોઈપણ સભાસદ વ્યવસ્થાપક સમિતીના સભ્ય તરીકે ચૂંટવાને પાત્ર ગણાશે નહિ સિવાય કે ચૂંટણી ની તારીખના પહેલાં ઓછામાં ઓછું પાંચ વર્ષ સુધી તે બેન્કનું સભ્ય પદ ધરાવતો હોય તે ચૂંટવા લાયક ગણાશે તેમજ જે સભાસદે સતત પાંચ વર્ષ ની મુદત સુધી રૂ. ૨૦,૦૦૦/- થી ઓછી ન હોય તેટલી રકમ બેન્કમાં થાપણ તરીકે જમા ન કરાવેલ હોય અને આવી રીતે જમા કરાવવાનું ચાલુ ન રાખે તો ડીરેક્ટર્સની ચૂંટણી મુજબના ઉમેદવાર માટે લાયકાત ગુમાવશે.	કોઈપણ સભાસદ વ્યવસ્થાપક સમિતીના સભ્ય તરીકે ચૂંટવાને પાત્ર ગણાશે નહિ સિવાય કે ચૂંટણી ની તારીખના પહેલાં ઓછામાં ઓછું પાંચ વર્ષ સુધી તે બેન્કનું સભ્ય પદ ધરાવતો હોય તે ચૂંટવા લાયક ગણાશે તેમજ જે સભાસદે સતત પાંચ વર્ષ ની મુદત સુધી રૂ. ૭૫,૦૦૦/- થી ઓછી ન હોય તેટલી રકમ બેન્કમાં થાપણ તરીકે જમા ન કરાવેલ હોય અને આવી રીતે જમા કરાવવાનું ચાલુ ન રાખે તો ડીરેક્ટર્સની ચૂંટણી મુજબના ઉમેદવાર માટે લાયકાત ગુમાવશે.	તા. ૨૪/૦૮/૨૦૨૩ ના વ્યવસ્થાપક મંડળ ના ઠરાવ નં. ૧૫ મુજબ બહાલી બાબતે સુધારો

Year	Members	Share Capital	Total Deposits	Total Loans & Advances	Working Capital	Net Profit	Audit Class
2013-14	11937	223.44	6515.12	2076.59	9383.15	55.81	A
2014-15	11758	220.79	6917.75	2105.45	9946.28	87.17	A
2015-16	11713	230.08	7287.33	2521.75	10456.70	70.14	A
2016-17	11659	238.74	9308.49	2629.20	12319.32	74.06	A
2017-18	11645	260.39	8875.86	3446.75	12126.58	87.73	A
2018-19	11633	278.84	9342.59	3916.79	12511.36	120.58	A
2019-20	11606	293.29	8968.73	4251.54	12320.33	109.54	A
2020-21	11540	296.47	9902.89	4622.13	13198.88	133.81	A
2021-22	11445	317.09	10675.59	4819.87	14138.40	126.71	A
2022-23	11480	344.63	10771.93	5377.13	14255.80	163.94	A



ALAVI CO-OPERATIVE BANK LIMITED

Digital Banking

ATM | Rupay Card | RTGS/NEFT
Mobile Banking | E-stamping



Mobile Banking



RuPay Debit Card



POS Machine



Concurrent Auditor

M/s. Amin Parikh & Co.
Chartered Accountant
Certified Auditor
FRN No. 100332W
Vadodara

Statutory Auditor

M/s. S. F. Tai & Associate
Chartered Accountant
Certified Auditor
FRN No. 114819W
Vadodara

Bankers

Reserve Bank of India
Gujarat State co-op bank, Ahmedabad
Baroda Central Co operative bank
State Bank of India, Vadodara
Bank of Baroda, Vadodara

Bankers

IDBI Bank, Vadodara
HDFC Bank, Vadodara
Axis Bank, Vadodara
ICICI Bank, Vadodara

અલવી કો.ઓપ બેન્ક લી.

કપ મી વાર્ષિક સાધારણ સભાની નોટીસ

અલવી કો.ઓપરેટીવ બેન્ક લિ. ના સભાસદોને જણ કરવામાં આવે છે કે બેન્કની "કપ" મી વાર્ષિક સાધારણ સભા તા. ૨૪/૦૯/૨૦૨૩ રવિવાર ના રોજ સવારે ૯.૦૦ કલાકે પંકિત દિનદયાલ નગરગૃહ આજવા રોડ ખાતે, નીચે જણાવેલ કામો સાફ મળશે. દરેક સભાસદને હાજર રહેવા વિનંતી છે.

- ૧) ગત સાધારણ સભાનો અહેવાલ વંચાણે લઇ બહાલ રાખવા બાબત.
- ૨) તા. ૩૧/૦૩/૨૦૨૩ નો રોજ પુરા થતા વર્ષના કામકાજનો અહેવાલ, સરવૈયુ અને નફાતોટા પત્રકના ઓડીટરે તપાસેલ હિસાબ મંજૂર કરવા તથા ઓડીટ રીપોર્ટ વંચાણમાં લેવા બાબત.
- ૩) નફાની વહેંચણી મંજૂર કરવા બાબત.
- ૪) સને ૨૦૨૩-૨૪ ના વર્ષ માટેના ખર્ચનું અંદાજપત્રક મંજૂર કરવા બાબત.
- ૫) સને ૨૦૨૩-૨૪ ના વર્ષ માટે બેન્કના હિસાબોના કોન્કરન્ટ ઓડિટ માટે ઓડિટરની કરેલ નિમણૂકને બહાલ રાખવા બાબત.
- ૬) તા. ૦૧/૦૪/૨૦૨૨ થી તા. ૩૧/૦૩/૨૦૨૩ દરમિયાન કોમ્પ્રોમાઇઝ સેટલમેન્ટ અંતર્ગત સેટલ કરેલ ધિરાણ ખાતાઓને મંજૂરી આપવા બાબત.
- ૭) વ્યવસ્થાપક મંડળ દ્વારા બેન્કના પેટા કાયદાઓમાં સામેલ Annexure-A માં દર્શાવ્યા મુજબ ભલામણ કરાયેલ સુધારાને મંજૂર કરવા બાબત.
- ૮) પેટા નિયમો અને ચૂંટણીના નિયમોમાં સુધારા વધારા કરવા બાબત
- ૯) ચેરમેનશ્રી ની સંમતિથી જે કાંઈ કામો રજુ કરવામાં આવે તેની ચર્ચા વિચારણા કરવા તથા નિર્ણય લેવા બાબત.

વડોદરા
તારીખ : ૦૯/૦૯/૨૦૨૩

વ્યવસ્થાપક મંડળના હુકમથી
ઇલૈયા સુરતી
(જનરલ મેનેજર ઇન્ચાર્જ)

ખાસ નોંધ

- ★ કોરમના અભાવે મુલતવી રહેલ સભા અડધા કલાક બાદ તે જ સ્થળે ફરીથી મળશે જેમાં કોરમનો કોઇ બાધ રહેશે નહીં અને સભાનું કામકાજ શરૂ કરવામાં આવશે.
- ★ અહેવાલમાં રજુ કરેલ આંકડાકીય માહિતી અંગે જે સભાસદને માહિતી જોઈતી હોય તેમણે સામાન્ય સભાના ચાર દિવસ પહેલાં લેખિત જણ કરવી ત્યાર પછી આવેલ અગર ચાલુ સભામાં રજુ કરેલ પ્રશ્ન સભા દરમિયાન ધ્યાને લેવામાં આવશે નહીં. પ્રશ્ન સ્વીકારવાની તમામ સત્તા ચેરમેનશ્રીની રહેશે.
- ★ સને ૨૦૨૨-૨૩ ના વર્ષના અહેવાલની નકલ જે સભાસદોને જરૂર હોય તેઓએ પોતાનું ઓળખપત્ર બતાવી બેન્કના કામકાજના સમય દરમિયાન હેડ ઓફીસના શેર વિભાગમાંથી મેળવી લેવા વિનંતી કરવામાં આવે છે.
- ★ બેન્કના સભાસદો માટે સને ૨૦૨૨-૨૩ ના વર્ષના કપ મા વાર્ષિક અહેવાલની નકલ બેન્કની વેબસાઇટ www.alavibank.com પર ઉપલબ્ધ છે.

Book Post

રવાના.
અલવી કો.ઓપ.બેન્ક લિ.
વાડી ચોખંડી.
વડોદરા-૩૬૦૦૧૭.

પ્રતિ, _____
